

# દાદાવાળી

સહનશક્તિની છદ

તંત્રી તથા સંપાદક :

દીપક દેસાઈ

વર્ષ : ૬, અંક : ૪

સંખ્યા અંક : ૬૪

ડિસેમ્બર, ૨૦૦૦

સંપર્ક સૂત્ર :

**ડૉ. નીરુભાન આમીન**

બી/૮૦૪, નવીનાશાશ્વ,  
દાદાસાહેબ ફાળકે રોડ,  
દાદર (સે.રે.), મુંબઈ-૧૪.

ફોન : ૯૧૩૭૬૯૬

Mobile : ૯૮૨૦-૧૫૩૯૫૩

અમદાવાદ : ૭૯૪૦૪૦૮

: ૭૯૪૩૮૭૭૮

ટેલી/ફેક્સ : ૭૯૪૫૪૨૦

E-Mail : dimple@ad1.vsnl.net.in

વડોદરા : ૯૪૧૬૨૭

સુરત : ૫૪૪૮૬૪

રાજકોટ : ૨૩૪૫૮૭

**DADAVANI ON INTERNET**  
<http://dadavani.tripod.com>

**DADA ON INTERNET**

[www.dadashri.org](http://www.dadashri.org)

[www.dadabhagwan.org](http://www.dadabhagwan.org)

Publisher & Printers:

**Mahavideh Foundation**

5, Mamta Park Society,  
Bh. Navgujarat College,  
Usmanpura,  
Ahmedabad-380014.

**લખાજમ**

આજીવન સભ્ય

ભારત : ૫૦૦ રૂપિયા

યુ.એસ.એ. : ૧૫૦ ડોલર

યુ.કે. : ૧૦૦ પાઉન્ડ

**વાર્ષિક સભ્ય**

ભારત : ૫૦ રૂપિયા

યુ.એસ.એ. : ૧૦ ડોલર

યુ.કે. : ૫ પાઉન્ડ

D.D. / M.O. ‘મહાવિદેહ

ફાઉન્ડેશન’ના નામે મોકલવો.

## સંપાદકીય

આ સંસારમાં મનુષ્યને જીવનમાં કંઈક પ્રકારે સહન કરવાનું આવતું જ હોય છે. હસબન્ડ કે વાઈફિ કે છોકરાં પજવતાં હોય તો ય સહન કરવું પડે, નહીં તો નોકરી-દંધામાં બોસ કે નોકર તરફથી સહન કરવાનું આવતું હોય છે. શાસ્ત્રીક દુઃખ-વેદના સહન થતાં નથી, ભાઈઓ-ભાઈઓના જ્યાદા-વેરમાં એકબીજાને સહન કરવું જ પડતું હોય છે, હડહડતું અપમાન થાય ત્યારે કેટલું અસહ્ય થઈ પડે છે. વિષય-વિકારના પરિણામમાં કેટલાં દુઃખો સહન કરવાં પડે છે અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ જેને ઊંચું હોય તેને તો આ સંસાર એક ક્ષણવાર સહન થતો નથી, પોષાતો નથી. આમ સહન કરતાં કરતાં સહનશક્તિની છદ આવી જાય છે. ત્યાં શાંતિ કેવી રીતે ચાખવી ? કચા ઉપાય ગોઠવવા કે જેથી સહન કરવાનું ઘટે અને અંદર સમાધાન-આનંદ વધે !

આ જગતનું સ્વરૂપ જ એવું છે. સુખ વગર પોતે રહી શકતો નથી. જ્યાં જ્યાં સુખની કલ્પના કરી છે, ત્યાં અંતે રીપેમેન્ટ આવ્યા છે, દુઃખ પરિણામો ભોગવવા પડ્યા છે. હવે ત્યારે પોતાને સમજાતું નથી કે મારે આ દુઃખ પરિણામો શા માટે ભોગવવા પડે છે. તે નિમિત્ત પ્રત્યે આદ્દેપ આચ્યા વગર રહી શકતો નથી અને નવા રાગ-દ્રેષ કરે છે. પરિણામે નવા કર્મો બાંધી સંસારની જંલામાં ગૂંચાય છે.

આ મુશ્કેલીઓ, વિટંબળાઓ, વેદનાઓ, દુઃખો જે સહન કરવા પડે છે તે તો ખરેખર ખૂબ ઉપકારી છે મોકા તરફ ધકેલવા માટે. દુઃખો સહન કરવાપણું ઈટસેફ્ટ મ્રું કરે છે કે આ સંજોગોમાં કે આ વ્યક્તિ દ્વારા પોતાને સુખ નહીં જ મળે. સુખ જે મળ્યું તે ટેમ્પરદી જ હતું ને પછી પાછું દુઃખ સહેવું જ પડ્યું. માટે સાચું સુખ આ બદાથી ઉપર હોવું જોઈએ. સાચું સુખ એનું નામ કે આવ્યા પછી જાય નહીં, સનાતન સુખ હોય. તે પ્રાપ્ત થયા પછી પરિસ્થિતિ-સંજોગો-નિમિતો લલે એનાં એ જ હોય છતાં પણ સહન કરવાપણું હોતું જ નથી.

પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આવી પડેલાં દુઃખોને સહન કરવા માટે અનેક પ્રકારની સમજાણ પ્રદાન કરી છે. તે એક એક ચાવી સમજુ લેતાં સહન કરવાપણું ક્યાંય નહીં રહે. સર્વ કાળે, સર્વ ક્ષેત્રે, સર્વ સંજોગોમાં નિર્ણતર સમાધાન જ વત્યા કરશે !

દીપક દેસાઈના જ્યા સચ્ચિદાનંદ ....

## સહનશક્તિની હદ

### જગૃત માટે સંસાર કેવો ?

કશી વાત પૂછો કંઈક ! ક્યાં સુધી આ ગુંચવાડામાં પડ્યા રહેશો ?

પ્રશ્નકર્તા : હમણાં તો કોઈ ગુંચવાડો નથી.

દાદાશ્રી : એ તો અત્યારે લાગે એવું બાકી, જમતી વખતે ટેબલ ઉપર મતબેદ પડે ને, તો ભાંજગડ પડી જાય. વાતે વાતે ગુંચવાડો છે, નર્યો શબ્દે શબ્દે ગુંચવાડો છે. જેટલો ગુંચવાડો નથી લાગતો એટલું બેભાનપણું છે, નહીં તો એક ક્ષણવાર સહન ના થાય એવો આ સંસાર છે. અમને તો આ સંસાર એક ક્ષણવાર સહન થતો નહોતો, કોઈ રાત હું ઊંઘો નહોતો ને એટલું બધું દુઃખ પાર વગરનું થાય !

### તો અધ્યાત્મ મીહું લાગે !

પ્રશ્નકર્તા : આ પેસા કમાવવા એ સારું ના લાગે, આ સંસારમાં રહીને આ જે બધી વિટંબણાઓ છે એ ભોગવવાની સારી નહીં લાગે. આવું બધું જ્યારે મનમાં આવે, ત્યારે પછી અધ્યાત્મ તરફ જવાની વૃત્તિ ઊભી થાય, એ બરાબર ?

દાદાશ્રી : આ સંસાર કડવું લાગે તો પેલું અધ્યાત્મ મીહું લાગે. આમાં કડવાશપણું લાગે નહીં, ત્યાં સુધી પેલું મીહું કેમ લાગે ?

પ્રશ્નકર્તા : એ જ વાત છે કે આ કડવું લાગે છે એટલે પછી મીઠા પ્રત્યે જવાય ને !

દાદાશ્રી : હવે કડવું કોને લાગે ? જે પૂર્વ ડેવલપ થતો થતો આવેલો તેને. ડેવલપ શેમાં થવાનું તો કે અહિસામાં. જેટલી અહિસા વધુ સમજ્યો એટલો ડેવલપ થયો. એ ડેવલપ થઈને આ સહન ના થાય. જાગૃતિ બહુ હોય.

### બળાપો વધે તેમ મોક્ષ ખોળે !

મનમાં ચોરીનાં વિચારો ખસતાં નથી, જૂઠનાં વિચારો, કપટનાં વિચારો ખસતાં નથી, પ્રપંચનાં વિચારો ખસતાં નથી. પછી શું, નર્યુ પાપ જ બંધાયા કરે ને ? આ તો બધું ના હોવું જોઈએ ! એટલા માટે હું તો બેખ (સંન્યાસ) લેવા તૈયાર હતો કે આમ જો દોષ બંધાતા હોય તો બેખ લેવો સારો. નર્યુ ભયંકર ઉપાધિઓ, આટલા તાપમાં બફાયા ! અજ્ઞાનતામાં તો બહુ સમજણવાળો માણસ, એક કલાક જે બફાય છે, એ બફારાને લઈને મનમાં એમ થાય કે બધ્યું, હવે કશું જોઈતું નથી. જાડી બુદ્ધિવાળાને બફારો ઓછો સમજણ પડે, પણ સૂક્ષ્મ બુદ્ધિવાળાને બફારો સહન કેમ કરીને થાય ? એ તો અજાયબી છે !

સંપૂર્ણ જાગૃત થયા પછી આ જગત એક ક્ષણ પણ સહન થાય તેમ નથી !

‘રિલેટિવ’ ધર્મની જરૂર ખરી. જ્યાં સુધી ‘રિયલ’ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ‘ડેવલપ’ થવા માટે, ખંડઈ, ખંડઈને વધે, તેમ તેમ બુદ્ધિ વધે. જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય ને બળાપો સહન જ ના થાય ત્યારે મોક્ષ ખોળે !

### ભૌતિક સુખોના પરિણામે...

બ્રહ્મ એ ‘રિયલ કરેકટ’ છે. અને આ બીજું બધું આંખેથી દેખાય છે, પંચેન્દ્રિયથી અનુભવમાં આવે છે, એ બધું ‘રિલેટિવ કરેકટ’ છે ! ખોટી તો કોઈ વસ્તુ છે જ નહિ આ જગતમાં. પણ જ્યાં સુધી ભૌતિક સુખોની જરૂર હોય; વિનાશી સુખો જોઈતાં હોય, તો આ ‘રિલેટિવ’ સત્યમાં બેસી રહો ને ત્યાં સુધી ‘રિલેટિવ’માં ભટક ભટક કરો. અને એ ભૌતિક સુખોની પાછળ કેટલી બધી ચિંતા, ઉપાધિઓ, નરી મુરુકેલીઓ વહોરવી પડે છે ! આ તરફડાટ બધો જ્યારે માણસ અનુભવે છે, ત્યારે સમજાય કે શી રીતે સહન કરે છે !! અને અવિનાશી સુખો જોઈતાં હોય તો ત્રિકાળવર્તી હોય ત્યાં જા. પેલું ‘રિલેટિવ’ એ

‘ફોરેન ડિપાર્ટમેન્ટ’ (સંસાર વ્યવહાર) છે અને ‘રિયલ’ એ ‘હોમ ડિપાર્ટમેન્ટ’ (આત્મ સ્વરૂપ) છે ! એટલે ‘ઘેર’ જવું હોય તો ‘ઘેર’ જવ અને ‘ફોરેન’માં રહેવું હોય તો ‘ફોરેન’માં રહો ! બાકી, ‘ફોરેન’ને ‘હોમ’ માનીશ તેમાં તારો કશો શક્કરવાર વળશે નહિ.

### મોક્ષનો પ્રયત્ન શા માટે ?

પ્રશ્નકર્તા : એક માણસ મરી ગયો પછી એને બીજો દેહ તરત જ મળે છે તો પછી લોકો મોક્ષને માટે શા માટે પ્રયત્ન કરે છે ?

દાદાશ્રી : જેને આ સંસારની ચિંતા થતી હોય અને એ ચિંતા ના ગમતી હોય, સહન ના થતી હોય તેને માટે મોક્ષની જરૂર છે. જેને આ ચિંતા ગમતી હોય તેને તો મોક્ષની જરૂર જ નથી ને ! એટલે દરેકને મોક્ષની જરૂર જ નથી. આ ફોરેનવાળાને ચિંતા સહન થાય છે, એમને મોક્ષની જરૂર જ નથી. આપણે અહીંના અમુક માણસોને ચિંતા સહન થાય છે, તો એમને ય મોક્ષની જરૂર નથી. બાકી જેને ચિંતા સહન થતી ના હોય, જેને અહીં સંસારમાંથી ભાગી છૂટવા જેવું લાગતું હોય, તેમને મોક્ષની જરૂર છે.

### આત્મભાને સમાધિ મરણ !

પ્રશ્નકર્તા : મૃત્યુનું દુઃખ કેવી રીતે સહન કરી શકાય ?

દાદાશ્રી : આ જ્ઞાન લીધા પછી મૃત્યુનું દુઃખ આવે જ નહીં ને ! જ્યાં જ્ઞાનનું આરાધન થાય, ત્યાં દુઃખનો વિચાર જ કરવાની જરૂર નથીને. એને સમાધિ મરણ હોય હુંમેશાં.

આપણા જ્ઞાન લીધેલા કેટલાય માણસો, એનો કાળ થયોને, તે બધાને સમાધિ મરણ ! તે વખતે સમાધિ મરણ જ થાય.

### ફરી વેદના વેદવા કોણ આવે ?

પ્રશ્નકર્તા : મોક્ષ થયા પછી આત્માની શી

ગતિ થાય ?

દાદાશ્રી : મુક્તભાવ ! સિદ્ધગતિ !! આત્મા સિદ્ધક્ષેત્રમાં જાય છે, ત્યાં પ્રત્યેક આત્મા છૂટા રહે છે અને જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહે છે. આ તમે હાથ ઊંચો કરો તો તે સિદ્ધ ભગવંતના જ્ઞાનમાં આવી જાય, પણ તેમાં તે જ્ઞેયાકાર ના થાય, જ્ઞાનાકાર જ રહે ! તેમને બંધન ના થાય. આ તો માના પેટે ફરી વેદના લેવા કોણ આવે ? એ વેદના તો ભગવાન જાણો! આ તો બધી વેદનાઓ બેભાનપણે ભોગવાય છે. માણસ જાતિ અમુક જ લિમિટ સુધી દુઃખ ભોગવી શકે, એનાથી વધારે જો દુઃખ પડે, તેની સહનશક્તિથી બહાર દુઃખ જાય તો તે બેભાન થઈ જાય.

### આપધાત કરતાં પહેલાં...

પ્રશ્નકર્તા : દાદા, એવું સાંભળ્યું છે કે આપધાત પછી આવી રીતે સાત ભવ થાય, એ વાત સાચી છે ?

દાદાશ્રી : જે સંસ્કાર પડે તે સાત-આઈ ભવ પછી જાય છે, એટલે આ કોઈ ખોટા સંસ્કાર પડવા ના દેશો. ખોટા સંસ્કારથી દૂર ભાગજો. હા, અહીં ગમે એટલું દુઃખ હોય તો તે સહન કરજો, પણ ગોળી ના મારશો, આપધાત ના કરશો. એટલે વડોદરા શહેરમાં આજથી થોડાં વરસ ઉપર બધાંને કહી દીધેલું કે આપધાત કરવાનું થાય ત્યારે મને યાદ કરજે ને મારી પાસે આવજે. એવા માણસ હોય ને, જોખમવાળા માણસ, એમને કહી રાખું. તે પછી મારી પાસે આવે, તેને સમજ પાડી દઉં, બીજે દહાડે આપધાત કરતો બંધ થઈ જાય. ૧૮૫૧ પછી યે બધાંને ખબર આપેલી કે જે કોઈને આપધાત કરવો હોય તો મને બેગો થાય ને પછી કરે. કોઈ આવે કે મારે આપધાત કરવો છે તો એને હું સમજાવું, આજુબાજુનાં ‘કોર્જિ’, ‘સર્કલ’ આપધાત કરવા જેવો છે કે નથી કરવા જેવો, બધું એને સમજાવી દઉં ને એને પાછો વાળી લઉં.

## દાદાવાળી

આ તો વગર કામનાં, શું કરવા આપધાત કરે છે ? આપધાત કરીને શું કામ છે ? તું પોતે જ ભગવાન છે. વગર કામનો તારે આપધાત કરવાની જરૂર જ શી છે ? પણ જો કોઈએ આવું કહ્યું જ નથી ને ! આ હું જેવું કહ્યું છું એવું કોઈએ એને કહ્યું જ નથી, પણ ખરેખર હકીકત એમ જ છે ને !

### એ ઉપાયો પણ અંતે દુઃખદાયી !

આ તો કંટાળાના ઉપાય કરે છે તે બ્રાંડી પીએ છે, દોડધામ કરે છે. એ ય એક જાતની મૂર્ખા જ છે. કંટાળો આવે પણ સહનશક્તિ છે નહીં, નહીં તો કંટાળો આવ્યો તો ‘શાથી આવ્યો ? શી ભૂલ રહી ગઈ ?’ એ બધી તપાસ કરાય. પણ એ તો કશું કરતા નથી ને દોડધામ કરે છે ને પીવે છે, તેનાથી રાહત મળે છે. પણ ફરી પાવર ઉતરે એટલે કંટાળો પાછો ચાલુ. આ સંસારનાં દુઃખો એક ક્ષણવાર શાંતિ આપે એવાં નથી.

એ તો કંપારી છૂટે કે આટલાં બધા દુઃખો આ લોકો સહન કરે છે આટલા સુખને માટે !

### આ તો લોનના સુખ !

એક છોકરો રૂપાળી છોકરી પાછળ પડેલો ! મેં કહ્યું, ‘આ કેરીઓ ઉપરથી રૂપાળી દેખાય પણ કાપીએ ને ત્યારે ખાટી નીકળે ! આ બધી હાઙ્કુસની કેરી જેવી રૂપાળી દેખાય ને ! પણ ખાટી નીકળે. મોહું બગડી જશે ત્યારે પછી ક્યાં જઈશ ? પછી આખી જિંદગી બફારો જ ને ? સહન ના થાય પછી ! કેરી તો ખાટી નીકળે તો નાખી દઈએ પણ સ્ત્રીને ક્યાં નાખી દઈએ ? ’

હવે, આ જે સુખો લો છો ને એ બધાં, તો લોન ઉપર લો છો, તે પાછાં રીપે (Repay) કરવાં પડશે. માટે ચેતીને ચાલજો, લોન ઉપર લીધેલાં સુખ બધાં રીપે કરવાં પડશે આ. આ વાઈફીની પાસેથી, છોકરા પાસેથી સુખ લઈ લઉં છું ને, લોન ઉપર લઉં છું એ રીપે કરવાં પડશે. જેટલું રીપે કરવાની

આપણી શક્તિ હોય એટલું લોન ઉપર લેજો અને પછી સહન નહીં થાય.

પરિણામ સહન કરવાની શક્તિ હોય તો લોન પર સુખ લેવા. તમારી પાસે ખોટું કરીને કોઈ પૈસા લઈ જાય તો તમને સુખ લાગે ખરું ?

### અનીતિ નોંટરે દુઃખો !

એક દારુ ના પીવાનો અહંકાર કરે છે ને એક દારુ પીવાનો અહંકાર કરે છે, તો મોક્ષ કોનો થાય ? ત્યારે ભગવાન બેઉને કાઢી મેલે ! એ તો શું કહે છે કે, ‘અમારે અહીં તો નિરાહંકારીની જરૂર છે.’ ભગવાન તો શું કહે છે, ‘નીતિ તો તને સંસારમાં સુખ પડે એટલા માટે પાળવાની છે. બાકી અમારે નીતિ-અનીતિની કશી ભાંજગડ જ નથી. તને દુઃખ સહન થતું હોય તો અનીતિ કરજે.’ અનીતિથી દુઃખ જ પડે ને ? કોઈને દુઃખ આચ્યા પછી આપણાને પણ દુઃખ પડે. આ તો તને સુખ પડે એટલા હારુ નીતિ પાળવાની છે.

### જીવન જીવો પરોપકારાર્થે !

આપણું જીવન કોઈના લાભ માટે જાય, જેમ આ મીણબત્તી બળે છે તે પોતાના પ્રકાશ માટે બળે છે ? સામાના માટે, પરાર્થ માટે કરે છેને ? સામાના ફાયદા માટે કરે છેને ? તેવી રીતે આ માણસો સામાના ફાયદા માટે જવે તો તારો ફાયદો તો એની મેળે મહીં રહેલો જ છે. આમેય મરવાનું તો છે જ ! એટલે સામાનો ફાયદો કરવા જઈશ તો તારો ફાયદો તો અંદર હોય જ અને સામાને ત્રાસ આપવા જઈશ તો તારે ગ્રાસ છે જ અંદર. તારે જે કરવું હોય તે કર. તો શું કરવું જોઈએ ?

**પ્રશ્નકર્તા :** પરોપકાર અર્થે જ જીવનું જોઈએ.

**દાદાશ્રી :** હા, પરોપકાર અર્થે જ જીવનું જોઈએ, પણ આ તમે હવે એવી લાઈન તરત જ બદલો તો આમ કરતાં પાછલાં રીએક્શનો તો આવે,

એટલે પાછા તમે કંટાળી જાવ કે આ તો મારે હજુ સહન કરવું પડે છે, પણ થોડો વખત સહન કરવું પડશે. ત્યાર પછી તમને કોઈ દુઃખ નહીં હોય. પણ અત્યારે તો નવેસરથી લાઈન બાંધો છો, એટલે પાછલાં રીએક્ષન તો આવવાનાં જ. અત્યાર સુધી જે ઉંઘું કર્યું હતું, તેના ફળ તો આવે જ ને ?

### આમ બંધાય વેર !

નિઃસ્પૃહ થવું તે ય ગુનો છે ને સસ્પૃહ થવું તે ય ગુનો છે. ઘરાક આવે તો સારું એટલું આપણે રાખવું, પછી ઉધામા ના રાખવા. ‘રેઝયુલારિટી’ અને ભાવ ના બગાડવો. આ તો એક દહાડો ઘરાક ના આવે તો નોકરને શેઠ ટૈડકાય ટૈડકાય કરે ! તે આપણે તેની જગ્યાએ હોઈએ તો શું થાય ? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવું નહીં, એ ય માણસજાત છે. એને બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઈ ને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય ! બિચારા ઉપર જરાક દ્યાભાવ રાખો ને !

### છંછેડ્યા તો સામા થાય !

જેમ તેમ કરીને અટાવી-પટાવીને કામ લેવા જેવો વખત છે. એક પેલું લોખંડ એકલું જ ગરમ થયેલું હોય, તેને જ ઘણા મરાય, બાકી બીજે બધે તો મરાય નહીં, એ ગરમ થયેલા લોખંડને ના મારીએ તો ય ઉપાધિ, એનો ઘાટ ના ઘડાય અને આ જીવતાં ને તો જરાક હાથ અડાડ્યો કે ખલાસ. તેમ છતાં ય પ્રકૃતિ જોઈ લેવી. આપણો કાયમનો નોકર હોય એની પ્રકૃતિ જોઈ લેવી. તેમાં બહુ વાંધો નહીં. આપણે જાણીએ કે આ ડાદ્યો છે, એ ડાદ્યા જોડે ડાહી વાત કરો તો વાંધો નહીં પણ આ બહારની પબ્લિક સાથે તો ચેતીને રહેવું. કારણ કે ક્યારે કોઈ માણસ કેવો અકળાઈ ઊઠ્યો છે એ શું ખબર પડે ? છતાં એ તમને જ ક્યાંથી ભેગો થઈ ગયો ? માટે સમજાવી કરીને એનાથી છૂટી જવું. આ વિચિત્ર કાળ છે. એટલે બિચારાને બહુ અકળાટ હોય છે. મહીં બહુ જ દુઃખ

હોય છે. તે જરા છંછેડો કે ચઘુ મારે. કશું વધારે પડતું દુઃખ સામાને ક્યારે દે ? પોતાનું દુઃખ સહન ના થાય ત્યારે જ ને ?

### સમજાવીને કામ લો !

બાબો ય ખોટું કરતો હોય, તો એને ધીબ ધીબ કરવાનો ના હોય. ખોટું કરતો હોય અને એને ધીબ ધીબ કરીએ તો શું થાય ? એક જણ તો લુગડાં ધુએ એમ ધોતો’તો. અલ્યા મૂળા ! બાપ થઈને આ છોકરાની આ દશા શું કરે છે ? છોકરો મનમાં શું નક્કી કરે છે તે જાણો છો તે ઘીંઘે ? સહન ના થાય ને, તે કહે, ‘મોટો થઉં એટલે તમને મારું, જોઈ લો.’ મહીં નિયાણું કરી નાખે એ ! પછી એને માર માર જ કરે રોજ મોટો થઈને પછી ! ત્યારે મૂળા અત્યારે શું કરવા બગાડ્યું છોકરાં જોડે ? રીતસર એને સમજાવી, પપલાવીને કામ લે ! હંમેશાં મારવાથી દરેક કામ બગડે છે. સમજાવવાની જરૂર છે, એને મારવાની જરૂર નથી. એટલે આ બાજુના અવળાં ભાવ કરવાના બંધ કરી દે પછી અને આ ખોટું છે એવું સમજાઈ જાય એને.

### આવું કેમ શોભે ?

બાકી કોઈને ય ભય નહીં પમાડવાં જોઈએ. આપણાને કોઈ ભય પમાડે, તે આપણે સહન કરી લેવાનું. કેટલાંક લોક ઘેર કોઈને મારામાર ના કરે પણ ભય બહુ પમાડે. બીતી ને બીતી રહે બિચારી, વાઈફી. છોકરાં રાત-દહાડો બીતાં ને બીતાં રહે. મૂળા, આવું શું કરવાં કરે છે ?! ભય તો કોઈ જીવ ના પામવો જોઈએ આપણાથી. આ ભય કોણ પમાડે કે વાઈલ્ડ જાનવરો છે, તે ભય પમાડે અને વાઈલ્ડ માણસો. જેવા જાનવરો વાઈલ્ડ હોય છે, એવા માણસો પણ વાઈલ્ડ હોય છે તે ભય પમાડે. બાકી આ ગાયો, ઘોડા કંઈ કોઈને ભય પમાડે ? એક દીપડો આવ્યો હોય તો આખા રોડ ઉપર માણસ આવુંપાછું થઈ જાય. એવા માણસો ય વાઈલ્ડ ખરાં. જોયેલા માણસો વાઈલ્ડ ?

### કોઈને હેરાન કરાય જ કેમ ?

એક વખત પુરુષને ડિલિવરી કરાવી હોયને તો બહુ મુશ્કેલી પડે. ના થાય આપણાથી સહન. એ તો એ જ સહન કરે. માટે એમાં શું સુખ છે બિચારીને ? તે એને હેરાન કરો છો વગર કામના. અરે, એવું થવાની આશા શું કરવા રાખો છો ? કો'ક ફરો પુરુષપણું મળે. ઉલટું સ્થીરોએ એવી આશા રાખવી જોઈએ કે અમે ક્યારે પુરુષ થઈએ !

### ઘરમાં કલેશ શાને ?

જે આપણા રક્ષણમાં હોય તેનું ભક્ષણ ક્યાંથી કરાય ? જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું, એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. એનો ગુંજો થયો હોય તો ય અનું રક્ષણ કરવું જોઈએ. આ પાકિસ્તાની સૈનિકો અત્યારે બધા અહીં કેદી છે, છતાં ય તેમને કેવું રક્ષણ આપે છે ! ત્યારે આ તો ઘરનાં જ છેને ? આ તો બહારના જોડે મિયાઉં થઈ જાય, ત્યાં ઝડપો ના કરે ને ઘેર જ બધું કરે. પોતાની સત્તા નીચે હોય તેને કચડ કચડ કરે ને ઉપરિને ‘સાહેબ, સાહેબ’ કરે. હમણાં આ પોલીસવાળો ટૈડકાવે તો ‘સાહેબ, સાહેબ’ કહે અને ઘેર ‘વાઈફ’ સાચી વાત કહેતી હોય તો એને સહન ના થાય ને તેને ટૈડકાવે. ‘મારા ચાના કપમાં કીડી ક્યાંથી આવી ?’ એમ કરીને ઘરનાંને ફક્કાવે. તેના કરતાં શાંતિથી કીડી કાઢી લે ને ! ઘરનાં ને ફક્કાવે ને પોલીસવાળા આગળ ધૂજે ! હવે આ ઘોર અન્યાય કહેવાય. આપણને આ શોભે નહીં. સ્ત્રી તો પોતાની ભાગીદાર કહેવાય. ભાગીદાર જોડે કલેશ ? આ તો કલેશ થતો હોય ત્યાં કોઈ રસ્તો કાઢવો પડે, સમજાવવું પડે. ઘરમાં રહેવું છે તો કલેશ શાને ?

### કલેશ ભાંગે એ જ સુખ !

અત્યારે તો બધે કલેશનાં મોજાં ફરી વળ્યાં છે. ખાતી વખતેય કલેશ અને જો આથી વધારે થાય તો માકણ મારવાની દવા લાવે. આજે તો સહન ના થાય

એટલે મૂઆ માકણ મારવાની દવા પી લે. તે શું એનાથી અંત આવી ગયો ? આ તો આગળ ઠેટ્યું તે અનેકગણું કરીને ભોગવવું પડશે ! તેના કરતાં ગમે તેમ કરીને આ વખત કાઢી નાખને ! આ તો નરી અણસમજણ જ છે.

મુક્તિનું સર્વશ્રેષ્ઠ અંગ એ કલેશ ભાંગવો તે. કલેશ ભાંગ્યો એ મોટામાં મોટું સુખ છે. ભલે જ્ઞાન ના હોય પણ ઘરમાં ઘરમ-કરમ છે, એમ ક્યાં સુધી કહેવાય ? ત્યારે કહે, ઘરમાં ગમે તેવાં વાતાવરણમાં પોતે સહન કરી લે ને અથડામણોમાં ય કલેશ ઊભો ના કરે, ભડકો ના કરે, એને જ ખાનદાની કહી છે. ત્યાં સુધી ભગવાનનો વાસો રહે. ઘરમાં કલેશ હોય ત્યાં બધું જ ખલાસ થઈ જવાનું. ભગવાનનો વાસો તો ના જ રહે અને લક્ષ્મીજી પણ ચાલવા માંડે !

### લોકસંજ્ઞાએ દુઃખ જ !

દુઃખ તો ક્યાં કહેવાય ? જ્ઞાનીની સંજ્ઞામાં દુઃખ તો છે જ નહીં. લોકસંજ્ઞામાં જ દુઃખ છે. જ્ઞાનીની સંજ્ઞાથી દુઃખ ક્યારેય આવે નહીં અને લોકસંજ્ઞાથી તો આમનો જાય તોય દુઃખ અને તેમનો જાય તોય દુઃખ, ત્યાં કોઈ દહાડોય સુખ નથી.

દુઃખ તો ક્યારે કહેવાય ? ખાવા ગયા હોય ને ખાવા મળે નહીં ને મહીં પેટમાં બળતરા થાય તેને દુઃખ કહેવાય. તરસ લાગી હોય તો પીવા પાણી ના મળે તે દુઃખ કહેવાય. નાક દબાવે તો પાંચ જ મિનિટમાં ગુંગળામણ થઈ જાય તે દુઃખ કહેવાય. આ બહારથી બીજું ગમે તેટલું ટેન્શન આવે તો ચાલે પડા ભૂખ-તરસ અને હવાનું ના ચાલે. કારણ બીજું બધું ટેન્શન તો ગમે તેટલું આવે તો સહન થાય, કંઈ તેથી મરી ના જવાય ! એ સિવાયનાં આ તો વગર કામના ટેન્શન લઈને ફરે છે.

### અનું નામ ખાનદાની !

આ માણસોને ઘૈડપણમાં પગ દુઃખે તો ડૉક્ટર

પાસે દોડે, દવા કરાવે. પણ આ પક્ષીઓને કે માછલાંઓને છે ડૉક્ટર ? એમને ભોગવ્ય જ કરવાનું, એમને છે એકે ય વિષય ? આહારસંશો હોય તેથી ખાવા જોઈએ, પણ જીભના વિષય નહિ. એમને ય જો ખાવા-પીવાના વિષયો હોય તો તેમને ય દાઢો દુઃખત, ચશમા આવત. જનાવરોને ય ઘૈંધુણીમાં દુઃખો આવવાનાં, પણ મુંગે મોઢે સહન કર્યા કરવાનાં તેમને !

પોતાનાં દુઃખો બીજાને રડીને કહેવાં એ તો કંઈ ખાનદાની કહેવાય ? પણ લોકો તો દુઃખો બધાંને કહેતાં ફરે. દુઃખો કહેવાની શક્તિ હોય છતાં સહન કરવું ને ના કહેવું અનું નામ ખાનદાની ! મોટો માણસ પોતાનાં દુઃખને સમાવી લે. કારણ કે એને એમ હોય કે એમાં કહેવા જેવું શું છે ? કાંઈ સામેવાળો આપણાં દુઃખ લઈ લેવાનો છે ? આ જનાવરો આવે છે કંઈ પોતાનાં દુઃખો કહેવાં ? આ કૂતરીનો પગ મોટર નીચે આવે તો એ કોને કહેવા જાય છે ? તે બિચારી ટસડાતી ટસડાતી ચાલે, તેને દવા-બવા કશું જ નહીં !

### હોટલમાંથી ભૂખ્યો ન જવા દીધો !

પ્રશ્નકર્તા : ધરમાં માકણ બહુ વધી ગયા હોય તો શું કરવું ?

દાદાશ્રી : એક ફેરો મારે ઘેર પણ માકણ વધી ગયા હતા ને ! બહુ વર્ષોની વાત છે. તે બધાં અહીં ગળા પર કરે ને, ત્યારે હું અહીં પગ પર મૂકતો હતો. અહીં ગળા પરનું એકલું સહન થતું નહોતું, એટલે અહીં ગળા પર કરે તો પગ પાસે મૂકતો હતો. કારણ કે આપણો હોટલમાં આવ્યો અને કોઈ ભૂખ્યો જાય, એ નકામું કહેવાય ને ?! એ આપણે ત્યાં જમીને જાય તો સારું ને ! પણ તમને એટલી બધી શક્તિ નહીં આવે. એટલા માટે તમને એમ નથી કહેતો. તમારે તો માકણ પકડી અને બહાર નાખી આવવું. એટલે તમને મનમાં સંતોષ થાય કે આ માકણ બહાર ગયો.

### કોઈને ડખલ ન કરો !

આપણે બ્રહ્માંડના માલિક છીએ. એટલે કોઈ જીવને ડખલ ના કરવી. બને તો હેલ્પ કરો ને ના બને તો કંઈ હરકત નથી. પણ કોઈને ડખલ ના જ થવી જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો કે પર આત્માને પરમાત્મા ગણવો ?

દાદાશ્રી : ના. ગણવાનું નહીં, એ છે જ પરમાત્મા. ગણવાનું તો ગપ્પું કહેવાય. ગપ્પું તો યાદ રહે કે ના પણ રહે, આ તો ખરેખર પરમાત્મા જ છે. પણ આ પરમાત્મા વિભૂતિ સ્વરૂપે આવેલા છે. બીજું કશું છે જ નહીં. પછી ભલેને કોઈ ભીખ માંગતો હોય, પણ તે ય વિભૂતિ છે અને રાજા હોય તે ય વિભૂતિ છે. આપણે અહીં રાજા હોય તેને વિભૂતિ સ્વરૂપ કહે છે; ભીખ માંગતાને નથી કહેતા. મૂળ સ્વરૂપ છે, તેમાંથી વિશેષતા ઉત્પન્ન થઈ છે, વિશેષ રૂપ થયેલો છે. એટલે વિભૂતિ કહેવાય અને વિભૂતિ તે ભગવાન જ ગણાય ને ! એટલે કોઈનામાં ય ડખલ તો ના જ કરવી જોઈએ. સામો ડખલ કરે તો એને આપણે સહન કરી લેવી જોઈએ, કારણ કે ભગવાન ડખલ કરે તો આપણે એને સહન કરવી જ જોઈએ.

### માંગ્યું સુખ, મળી પરવશાતા !

આ કરોળિયો જાળું વીટે, પછી પોતે મહી પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું પોતે જ ઊભું કરેલું છે. ગયા અવતારે પોતે માંગણી કરી હતી. બુદ્ધિના આશયમાં આપણો ટેન્ડર બર્યું હતું કે એક સ્ત્રી તો જોઈશે જ. બે-ગ્રાણ રૂમ હશે, એકાદ છોકરો ને એકાદ છોકરી, નોકરી એટલું જ જોઈશે. તેને બદલે વાઈફ તો આપી તે આપી, પણ સાસુ-સસરો, સાળો-સાળાવેલી, માસી સાસુ, કાકી સાસુ, ફોઈ સાસુ, માભી સાસુ, ..... હેય ફસામણ, ફસામણ !!! આટલી બધી ફસામણ જોડે આવશે એવી ખબર હોત

## દાદાવાળી

તો આ માંગણી જ ના કરત બળી ! આપણે તો ટેન્ડર ભર્યું હતું વાઈફ એકલીનું, તે આ બધું શું કરવા આચ્છું ? ત્યારે કુદરત કહે છે, ‘ભઈ, એ એકલું તો ના અપાય, માઝી સાસુ, ફોઈ સાસુ એ બધું આપવું પડે. તમને ત્યાર વગર ગમે નહીં. આ તો લંગર બધું હોય ત્યારે જ બરાબર મજા આવે !!’ એક આટલું લેવા જઈએ ત્યાર હોરું કેટલી વળગાડ, કેટલી બધી પરવશતાઓ ! એ પરવશતા પાછી સહન થાય નહીં.

### સંસારના સુખો કેવા ?!

અવસ્થામાં સુખ હોય નહીં. અવસ્થા તો નિરંતર ફર્યા કરવાની. બગીચામાં સુખ હોય તો પાછું વેર આવવું પડે છે, એના કરતાં આ દુઃખના હંલ્લામાં પડ્યા રહીએ કે જે જગ્યાએ દુઃખ છે ત્યાં જ પડ્યા રહીએ તો સુખ થાય. દુઃખ સહન કરનારને સુખ ઓટોમેટિક આવ્યા કરે, કારણ કે તાપમાં ચાલેવાને બાવળિયા નીચે સુખ આવે જ, અને જો કોઈને બાવળિયા નીચે સુખ ના આવતું હોય તો તેને ચાર-પાંચ કલાક તાપમાં ફેરવીએ તો ત્યાં ય તેને સુખ લાગશે. આ સંસારની કલુષિત કિયાને એનાં ફળ રૂપે સુખ ઉત્પન્ન થાય છે ! પછી એ વેર જઈને પંખો ફેરવીને બેસે તો ‘હાશ, સુખ થયું’ કહે ! પછી એ નિરાંતે ચા-પાણી પીએ. અને આખો દા’ડો ઘરમાં બેસી રહેલા શેઠને પંખો ફેરવે તો ના ફાવે, ચા-પાણી ના ગમે. આ સંસારમાં કોઈ પણ સુખ છે એ થાક્યાનાં ફળ રૂપે છે. તાત્ત્વિક સુખ-સનાતન સુખ આવે પછી ક્યારેય પણ જાય નહીં !

### ‘દાદા’ વેલિંગ કરે, કેક એન્જિનને !

દુઃખ માણસથી સહન ના થાય એટલે મગજમાં કેક પડે. એને સનેપાત ના કહેવાય, પણ કેક કહેવાય. આપણાને એમ થાય કે આવું કેવું બોલે છે ? ત્યારે આપણે કહીએ કે આ એન્જિનને કેક પડેલી છે, તેને દાદા પાસે વેલિંગ કરાવી લેજે. નવા

એન્જિનને ય કેક પડી જાય ! દુઃખ સહન ના થાય ને સાચો પુરુષ હોય તો કેક થાય, નહીં તો નફફટ થાય. નફફટ કરતાં કેક સારા, કેકને તો અમે વેલિંગ કરી આપીએ એટલે એન્જિન ચાલુ થઈ જાય છે. બધાં નવાં જ એન્જિનો, લેંકેશાયરમાંથી આણોલાં, પણ હેડ કેક થેયેલાં તે ચાલે શી રીતે ? આ માણસોને ય હેડમાં કેક પડી જાય. તે તૃતીયમૂલ્ય જ બોલે. આપણે પૂછીએ શું ને એ બોલે શું ??!

### દુઃખો, ગો દુઃખ દાદા !

અને બહું દુઃખ આવી પડે ત્યારે તમારે કહેવું કે જાઓ ‘દાદા’ પાસે.

**પ્રશ્નકર્તા :** પણ દાદા, એવું અમારું દુઃખ તમને અપાય ?

**દાદાશ્રી :** હા, હા. દાદાને જ બધું આપી દેવાનું ને કહીએ કે “જા, દાદાની પાસે. અહીં શું છે ? ઈધર કયા હૈ ? સબ દે દિયા દાદાકો. અબ ઈધર ક્યો આયા ?”

**પ્રશ્નકર્તા :** સુખે ય આપી દેવાનું ?

**દાદાશ્રી :** ના, સુખ નહીં. સુખ તમારી પાસે રાખવાનું. મને સુખનો શોખ નથી એટલે તમારી પાસે રાખવાનું. તમારાથી દુઃખ જો સહન ના થાય તો મારી પાસે મોકલી દેવાનું. બે-પાંચ વખત દુઃખનું અપમાન કરો કે ઈધર ક્યો આયા હૈ ? દાદા કો દે દિયા હૈ એટલે એ ઊભું ના રહે. આ પુદ્ગળનો ગુણ કેવો છે કે અપમાન થાય તો ઊભું ના રહે.

### વેદના વખતે માંગવી શક્તિઓ !

તમારે કેટલી ‘ફાઈલ’ છે ?

**પ્રશ્નકર્તા :** મારે તો એક જ ‘ફાઈલ’ છે, વેદનીયની.

**દાદાશ્રી :** હવે એ વેદનીયને એમ કહેશો કે, ‘અહીં આવશો નહીં.’ ત્યારે વેદનીય આઠ ફીટ ઊંચી

હતી, તે એંસી ફીટ ઊંચી થઈને આવશે અને આપણે કહીએ કે તમે વહેલા આવો તો આઠ ફીટની હોય, તે બે ફીટની દેખાય અને વેદનીયનો કાળ પૂરો થઈ ગયો તો એ ઉભી ના રહે. તો જે ઉભી રહેવાની નથી, તે તો આપણા ‘ગેસ્ટ’ કહેવાય. ‘ગેસ્ટ’ જોડે તો આપણે સારું વર્તન રાખવું જોઈએ ને? સંયમ રાખવો પડે. તમને શું લાગે છે?

પ્રશ્નકર્તા : લાગે તો છે દાદા, પણ સહન નથી થતું.

દાદાશ્રી : એ સહન નથી થતું, એ ‘સાયકોલોજિકલ ઈફેક્ટ’ છે. તે ‘દાદા, દાદા’ એમ નામ લઈએ ને ‘મને સહનશક્તિ આપો’ એમ કહીએ તો તેવી શક્તિઓ ઉત્પન્ન થાય.

### જાણો પારકું સ્વરૂપ, ત્યાં ભોગવટો નહીં !

પ્રશ્નકર્તા : બે દાદાશ્રી માથું દુખતું હતું. તે જરા ય સહન થતું નહોતું.

દાદાશ્રી : ‘મને સહન થતું નથી.’ એવું કહ્યું કે એ વળગ્યું ! પણ ‘આપણે’ તો કહીએ, “ચંદુભાઈ, બહુ માથું દુઃખે છે ? હું હાથ ફેરવી આપું છું. ઓફું થઈ જશે.” પણ ‘મને દુઃખ્યું કહ્યું કે વળગ્યું ! આ તો બહુ મોટું ભૂત છે !’

પ્રશ્નકર્તા : જ્યાં સુધી આત્માનું સ્પર્શ વેદન ના હોય, અનંત સ્વરૂપનું વેદન ના હોય ત્યાં સુધી બીજું કંઈ ને કંઈ તો વેદન હોય ને? જેમ કે શાતા-અશાતા !

દાદાશ્રી : એવું છે ને કે વેદનાનો સ્વભાવ કેવો છે કે જો એને પારકી જાણે તો એ જાણ્યા કરે કે આ પારકી છે. પછી ખાલી જાણ્યા જ કરે એને, વેદે નહીં. પણ આ વેદના ‘મને થઈ’ કહે તો વેદે અને આ ‘સહન થતી નથી’ એમ બોલ્યા એટલે વેદના દસ ગણી લાગે. આ ‘સહન થતી નથી’, એમ તો બોલાય જ નહીં.

### બોલે તેવી અસરો !

કોઈ કષાયી વાણી બોલે તમારી જોડે તો તે તમારથી સહન થાય કે ?

પ્રશ્નકર્તા : એ જરા દૂર છે એટલે બહુ ના લાગે.

દાદાશ્રી : સામાન્ય રીતે આ મનુષ્યનો સ્વભાવ કેવો હોય ? પેલું શારીરિક દુઃખ સહન કરે, પણ કષાયી વાણી સહન ના કરે ! માની બેઠાં છે કે આ મને અદેલું જ છે. હવે એટલું અદેલું ય નથી ત્યાં આગળ. ખાલી સ્પર્શ જ છે. ખાલી આત્માનો ને પુદ્ગલનો બેનો સ્પર્શ થાય છે. એકાકાર કોઈ દહાડો થયું નથી. હવે આત્માનો એવો ગુણ છે કે બોલતાંની સાથે જ જેવું બોલે તેવી અસર થઈ જાય. માટે ક્ષત્રિયપણું વાપરવું પડે. થોડો વખત અમારા ટચમાં રહેવું પડે.

### રાગ-દ્રોષ વિનાની વેદનામાં ચીસ !

પ્રશ્નકર્તા : દાદાને આપણે યાદ કરીએ દાદા આપણી સામે જ છે એવું રહે, હું ચંદુભાઈ નથી એમ પણ રાખ્યું, પણ પેલું પસ કાઢેને, પેટમાં પાક્યું હતું તે ઘડીએ ચીસ પડાઈ જાય, આંખમાંથી પાણી નીકળી જાય.

દાદાશ્રી : તે તો નીકળેને ! પાણી નીકળે તેમાં સારું ઉલ્લંઘન, આંખમાંથી પાણી નીકળે ચીસ પાડે તે સારું. ચીસ ના પડે, પાણી ના નીકળેને તો લોક કહે કે આ ધર્મમાં નથી, આત્મધર્મમાં નથી, દેહધર્મમાં છે, કારણ કે એ અહંકાર ધર્મ કહેવાય. પાણીય ના નીકળવા દે. ચીસેય ના પડવા દે. દેહ એવી ચીસો પાડ્યા જ કરે. ભગવાન મહાવીરનેય પેલું કાનમાથી બરું કાઢ્યું હતુંને, તે ચીસ કરીને રડવા ! તે આંખમાંથી નીકળી જાયને, ત્યારે લોક શું કહે કે ન હોય આ ભગવાન ! ભરા ભગવાન જ આ કહેવાય ! રે નહિ અને બૂમ ના પાડે તો જાણવું કે આ ભગવાન ન હોય, એ અહંકારે કરીને રે છે.

પ્રશ્નકર્તા : અહંકારે કરીને ?

દાદાશ્રી : આ દેહને જે વર્તતું હોય તેથી વાંધો નહીં આપણને, હસતો હોય તોય વાંધો નહીં. આપણને રાગ-દ્વેષ ના થવા જોઈએ. બીજું બધુંય આપણને નહે નહીં કશુંય.

**અશાંતામાં જાણપણું, ઝાનીને !**

પ્રશ્નકર્તા : આપ જે કહો છો કે દુઃખનો અનુભવ આપને કંઈ થયો નથી. છેલ્લા છિંબીસ વર્ષથી તો એ અશાંતા વેદનીય કર્મનો ઉદ્ય નથીને, શાતાવેદનીય કર્મનો ઉદ્ય ચાલે છે. અને આગળ જતાં અશાંતા વેદનીયનો ઉદ્ય કદાચ થાય પણ ખરો, એમ બની શકે ખરું ?

દાદાશ્રી : અશાંતા વેદનીયનેય હું જાણું છું. બાકી અશાંતા વેદનીય ઉલ્લી નથી થઈ. આ પગે ફેફચર થયું તોય ડોક્ટરો બધાં ભેગાં થયા અને જોવા માંડ્યા, મને કહે છે કે આ તમને મોઢાં પર આનંદ છે, કેમ તમને દુઃખ નથી થતું ? તમે બહુ સહન કરો છે. મેં કહું, સહનશીલતા મારામાં અંશ ના હોય. સહનશીલતા એ અહંકારી ગુણ છે. ઈગોઈજમનો ગુણ છે. અમારામાં અંશ ઈગોઈજમ ના હોય. અમારે આ નિર્જવ ઈગોઈજમ કામ કરી રહ્યો છે, સજવ ઈગોઈજમ નહીં. નિર્જવ ઈગોઈજમથી આ ખાવાનું, પીવાનું હરેક કાર્ય થયા કરે.

**દુઃખમાં થઈ જાય લાયાર !**

આ બધા જે મોટા માણસો છે ને, એ જ્યારે પેટમાં દુઃખ ને, ત્યારે ‘ઓ મા-બાપ ! તમે કહો એ કરું’ કહે. તે ઘરીએ લાયાર થાય. મહી દુઃખ થાય છે ત્યારે ‘ડોક્ટર, મને બચાવજો’ કહે. એવી લાયારી કરે. આ લોકો બહુ સુંવાળા હોય, તે દુઃખ સહન ના થાય. ગુરુત્વમ થવા ગયા ને, તેનું પૂંડિયું દહાડે દહાડે બહુ સુંવાળું થઈ જાય. અને લઘુત્વમ થવા માટે તો કઠણ પૂંડિયું જોઈએ. કહેશે, ‘તારે જે કરવું હોય તે કર !’ પણ લાયારી ના હોય એને.

**કોણ મોટો અહંકારી ?**

બુદ્ધિ બધી હેરાન કરે. કશું દુઃખ હોતું નથી અને પોતે એમ માની બેસે છે અને અહંકાર જ કામ કરે છે. ભારે અહંકાર ! ક્યાંથી આટલો બધો અહંકાર !! મારા મોટાભાઈ બહુ અહંકારી હતા. લોક બહાર એમને કહે કે એ અહંકારી છે. અને મને બહુ ડાખ્યો કહે. પણ મારા મોટાભાઈ મને શું કહે ? તારા જેવો અહંકારી મેં ગુજરાતમાં જોયો નથી. એટલે મેં એમને પૂછ્યું, કઈ રીતે તમે મને અહંકારી કહો છો ? ત્યારે કહે, ‘તારો અહંકાર એ છૂપો અહંકાર છે. મને બધું સમજાઈ ગયું છે.’ પછી મેં તપાસ કરી, ત્યારે મને એવું લાગ્યું કે આ તો બહુ મોટો અહંકાર છે. અને પછી બહુ કેડવા માંડ્યો. કેડે તો સહન ના થાય. શી રીતે સહન થાય ??!

**અહંકાર શું ના કરે ?!**

હરીફાઈમાં ય કેવી પદ્ધતિ હોય છે, કે કેટલીક નાતો તો પોતાનો છોકરો આગળ વધતો હોય તો વધવા દે અને રક્ષણ આપે, કેટલીક નાતો એવી હોય છે કે પોતાની લેન્થથી ત્રણ છોકરા બરોબરીમાં નજીક ચાલતા હોય, અને એક છોકરો પાછળ પડી ગયો હોય તેને ઊંચકીને લઈ આવે પોતે, ભાઈઓ, માબાપ, બધા ય ઊંચકીને લાવે ને બધું આપીને લઈ આવે પણ એક ડગલું આગળ ગયો હોય તો બાપ પાછો પાડે, મારીને. એનું કારણ શું ? બાપાથી સહન ના થાય. મારાથી વધ્યો એ, અને પાછળ પડ્યો તે ય સહન ના થાય. એ અમુક કોમ્યુનિટીમાં ખાસ મેં જોયેલું. કોઈ બાપ કોઈ છોકરાને વધવા જ ના દે, મારી ઠોકીને પાછળ પાડે બિચારાને. પછી મેં શોધખોળ કરી, મેં બધાને કુટુંબમાં કહું કે તમે બધા આગળ વધો અને મને શીંગડાં લઈને મારવા આવો બધા. મારી પાસે શીખીને બધાં. મારી પાસેથી શીખો, વધો ને પછી મને મારવા આવો. એવા થજો. પણ પાછળ ના રહી જશો. બીજા લોકો કોઈને આગળ વધવા ના દે. એ મેં જોયેલું ખાસ. તમારામાં ય કેટલાંક આગળ વધવા નથી દેતાં. મહી કેટલા અંશે વધવા દે છે, સારી રીતે. અને લોક તો

## દાદાવાળી

સામાવાળાને મારે એક થપોટ તે પાછો પાડી દે ! અત્યા, બાપ કરતાં સવાયો નીકળ્યો ? તે આજે મુશ્કેલી બહુ, આ સંસારમાં તો ? પોતાનો અહંકાર શું ના કરે ? બધાંને પાછા પાડી નાખે ? ના પાછો પડે તેને ખોતરીને કાઢી નાખે. અને તમારો સગો ભાઈ જો બહુ અહંકાર કરે ને તમારા બધા જોડે, તો બધા ભેગા થઈને એનું કાટલું કાઢી નાખે. હા, એને તો દુઃખી કરી નાખે ત્યાર વગર સીધો નહીં થાય. સીધો કરવા માટે એને દુઃખી કરી નાખે. શાથી ? બહુ અહંકાર કરે, એટલે બાપે ય સહન ના કરી શકે. અહંકાર એટલો નાપાક ગુણ છે કે બાપ પણ સહન ના કરે. ભઈ પણ સહન ના કરી શકે. ભાઈ પણ આશીર્વાદ આપે કે વહેલામાં વહેલી તકે આનું સારું થઈ જાવ. એ અહંકાર તો બહુ મોટી વસ્તુ છે. આપણે જો ભાઈઓને બધામાં વધવું હોય તો નમ્રતા રાખવી જોઈએ. તો જ વધવા દે. નહીં તો મારી મારીને ટેબાં કાઢી નાખે. સંસાર છે આ તો !

એક બાજુ અહંકારથી ઊભો થયેલો છે, અહંકાર એટલે વિકલ્પથી. આત્માનો વિકલ્પ એટલે અહંકાર. હું અને મેં કર્યું. બસ ચાલ્યું પછી. પછી માર ખાય છે તો ય પણ અહંકાર છોડે નહીં એને, કારણ કે ઘરી પછી એને એમ જ લાગે કે મારા આ ચાર બણદ, આ ગાયો-બાયો, આ બધાં કરતાં હું મોટો નથી. એના કરતાં આપણા પોતાના ગામ જતા રહોને, એના જેવું કોઈ સુખ નથી. પોતાના દેશમાં જે સુખ છે એવું કોઈ દેશમાં નથી.

### અહંકાર એટલો માર !

પ્રશ્નકર્તા : અહંકાર હોય તો જ માણસ કંઈક આગળ વધી શકેને ?

દાદાશ્રી : એ અહંકાર છે માટે નહીં. હવે જ્ઞાન મળ્યા પછી અહંકાર છે એ કેવો છે ? જેમ આપણે અહીંથી બોરીવલી ગયા હોઈએ સત્તસંગ માટે, પણ

પાછું તો આવવું પડેને ? એવું આ પાછો જતો અહંકાર, જે મોક્ષ જાય છે, તે ઉત્તરતો અહંકાર, સમાઈ જતો અહંકાર. અને પેલો ઉત્પાત કરતો અહંકાર.

પ્રશ્નકર્તા : એ અહંકાર ઉત્તરતો જાય, એમ સમતા ભાવ આવતો જાય ?

દાદાશ્રી : જેટલો જેટલો સમતા ભાવનો થાય, એટલો એટલો ઉઘાડ ઉત્પન્ન થાય. એટલું એટલું અજવાણું દેખાતું જાય અને સંપૂર્ણ મમતા થઈ ગઈ એટલે પૂર્ણ ઉઘાડ થઈ જાય. અહંકાર અંધારામાં છે. માર ખા-ખા કર્યા કરે છે જાત જાતનો !

પ્રશ્નકર્તા : ‘હું છું’ એ મહી હોય તો માર બહુ ખાવો પડે ?

દાદાશ્રી : માર ખાવો જ પડેને ! પણ માર ખાયને એટલે જ પછી છોડી દેને, ‘હુંપણું’ છૂટતું જાયને ! માર ખાધા વગર છૂટે નહીં. અનુભવ થવો જોઈએ. પ્રતિકમણથી જાય નહીં એ.

પ્રશ્નકર્તા : એ પોતાનું ‘હુંપણું’ હોય, કંઈક છું, હું આ કરી શકું છું, એ શાનાથી જાય ?

દાદાશ્રી : માર ખાય તો જ છૂટે, નહીં તો છૂટે નહીં.

પ્રશ્નકર્તા : એવુંય બનેને, માર ખાય, તો એને ભૂલ ખબર પડે એ વસ્તુ જુદી છે, પણ જ્યારે માર ખાય તો પછી એના રિએક્શનમાં ઊંઘી ટ્રેક પર ચાલે એવુંય બનેને ?

દાદાશ્રી : કોઈ અવળો થઈ જાય. અવળો ખરેખર થઈ જાય. જો કે આપણા જ્ઞાનમાં ના થાય. પણ બીજા જ્ઞાનમાં તો થઈ જાય. આપણું જ્ઞાન તો એને હેલ્ય કરે, પાછું જોવડાવે કે મારી કંઈ ભૂલ થાય છે એવી ખબર પડે. થોડે છેટે જાય તોય !

પ્રશ્નકર્તા : એ તો પછી પોતાને બળતરા થાયને ?

## દાદાવાળી

**દાદાશ્રી :** એ બળતરા જ એને કહે કે, આ ભૂલ થઈ ગઈ. એટલે પાછો ફરી જાય. કારણ કે બળતરા વગરના હિવસ જોયાં છે એણે. એટલે એને બળતરા થઈ કે પાછો ફરી જાય. એટલે લોકો કહે છે ને કે તમારા જ્ઞાનમાં દાદા પેઠાં પછી હવે આધુપાછું જતું રહેવું હોય તો જતું રહેવાય એવું થાય નહીં. હવે અહીંથી જવાય જ નહીં. નહીં તો બળતરા ઉભી થઈ જાય એને બળતરા સહન થાય નહીં પાછી.

### ઐશ્વર્ય ઘટયાના પરિણામ !

જેટલું ચિત્ત વિખરાયું એટલું ઐશ્વર્ય ખલાસ થઈ ગયું.

**પ્રશ્નકર્તા :** એ એકજેક્ટલી કેવી રીતે ખબર પડે કે આ ઓછું થઈ ગયું, એ ?

**દાદાશ્રી :** ખબર પડે જ છે ને અત્યારે કે ઐશ્વર્ય ઓછું છે ! તેથી તો કેટલાક લોકો ડખો કરે છે, લોકોનું સહન કરવું પડે, લોકો સહન કરે, કોઈ બોસ ટૈડકાવે. એવું સહન ના કરવું પડે ?

**પ્રશ્નકર્તા :** હા, સહન કરવું પડે છે.

**દાદાશ્રી :** એ ઐશ્વર્ય ઓછું ત્યારે જ ટૈડકાવે. નહીં તો ઐશ્વર્ય હોય તો એ શું ટૈડકાવે ? એટલે ઐશ્વર્ય ઓછું, તેનું ને ! ઐશ્વર્ય હોય તો તો એને કોણ ટૈડકાવનારો. ટૈડકાવવા માટે આવે ને, તે મોહું જોતાં પહેલાં આમ આમ થઈ જાય કે ‘શું થશે, શું થશે’ કારણ કે ઐશ્વર્ય છે. જોતાંની સાથે જ એને ગભરામણ, પસીનો છૂટી જાય ! માટે ઐશ્વર્યની જરૂર છે. બીજું કશું જરૂર નથી !

અને ચિત્તની સંપૂર્ણ એકાગ્રતા, એ પરમાત્મા. જેટલું ચિત્ત વેરાયું એટલી ઐશ્વર્યતા તૂટી ગઈ. ચિત્ત વેરાયું એટલે ઐશ્વર્ય તૂટ્યું !

### શીલનો પ્રભાવ !

એવું છે કે કોઈ સંજોગોમાં છોકરો સામો થાય, વાઈફ કોઈ સંજોગોમાં સામી થાય, તે ઘડીએ

તમે લપકા કરો તો તમારું શીલ ખલાસ થઈ જાય. એનાં કરતાં આપણે જોયા કરવાનું કે આ મશીન કંઈ બગડેલું લાગે છે. તે કઈ બાજુથી મશીન બગડ્યું છે તે જોયાં કરવું. નહીં તો આ લોક તો શું કરે કે ‘તું આવી છું, તું તેવી છું’ કહે એટલે થઈ રહ્યું, શીલ એનું ખલાસ થઈ ગયું. અમને તો કોઈ લાખ ગાળો ભાડે તો ય અમે કહીએ કે આવ બા, ત્યારે કોઈ કહેશે કે છોકરો સામો થાય છે તો અત્યારથી ડરાવીએ નહીં તો તો પછી એ વધારે સામો થશે. ના, એ ડરાવવાથી તો તમારું શીલવાનપણું તૂટ્યું જશે ને તમારે નિર્ભળતાઓ વધતી જશે, અને છોકરો ચઢી બેસશે ! એટલે તમે જો એને ડરાવશો નહીં અને તમે એ સહન કરીને સાંભળી લેશો તો ધીમે ધીમે એ ‘ટર્ન આઉટ’ થઈ જશે. એ આ શીલના પ્રભાવને લીધે !

### ચેતવું વિષયના જોખમથી !

જેટલા હિસાબ બાંધવા હોય એટલા બાંધજો. જેટલી મજબૂતી હોય એટલાં હિસાબ બાંધજો, બાકી ભોગવતી વખતે સહન ના થાય ને રડારડ કરે, એનાં કરતાં પહેલેથી જ ચેતીને હિસાબ બાંધજો. એ બધા હિસાબ છોડવા તો પડશે ને ? વિષયની વેદના કરતાં નર્કની વેદના સારી. આ વિષય તો બીજ નાંખે પાછું. નર્કમાં બીજ પડે નહીં, નર્કમાં ભોગવવાનું એકલું જ, ડેબિટ પૂરી થઈ ગઈ. અને કેટિટ હોય તો ત્યાં દેવગતિમાં પૂરી થાય છે. જ્યારે વિષયમાં તો નવાં બીજ પદ્ધતા વગર રહે જ નહીં. આ તો અમને બહુ નાનપણમાંથી વિચારો આવતા, બધા બહુ વિચારો કરી નાખેલા.

આ તો અકમ વિજ્ઞાન છે. તેથી આટલું જ જોખમ રાખ્યું. બાકી જૈનધર્મ તો બીજું બધું ય જોખમ જ કહ્યું છે. બધાને જોખમ કહીએ તો ક્યારે પાર આવે ?! તો લોક શું કહેશે પછી કે ‘મારે તમારી જોડે ધંધો જ નથી કરવો, સોદો જ કરવો નથી.’ પણ એક બાબત હોય તો કહેશે કે ‘બધું જ સહન કરી લઈશ

પણ આ એક જ બાબત છે ને, તો તો એને સાચવીશ.' અને તો એને વિજ્ઞાનનો લાભ મળે ને ! એટલે આપણે તો આ એક જ બાબત કહી છે.

### વિષય છૂટે, એ આનંદ અપાર !

જેના વિષય છૂટ્યા, એને મજા ! એ આનંદ પણ એવો જ લુંટવાનો હોય ને ?! એ ય અપાર આનંદ !! એ આનંદ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય, એવો આનંદ ઉત્પન્ન થઈ જાય. પાંત્રીસ વર્ષનો પીરિયડ કાઢી નાખે ત્યારે અપાર આનંદ ઉત્પન્ન થાય. વિચારક હોય, તેને તો વિષય ગમે જ નહીં ને ? આ બ્રહ્મચારીઓને ઉદ્ય આવ્યો છે, એ જ ધન્યભાગ્ય કહેવાય ને ? પાંસરી રીતે પાર પાડવું પડે. પહેલાં પોતાની જાત પર શ્રદ્ધા હોવી જોઈએ. બાકી, વિષયની જરૂરિયાત તો જે સુખી હોય, તેને હોય જ નહીં. બહુ માનસિક મહેનતવાળાને વિષયની જરૂરિયાત છે. બહુ મહેનત કરતા હોય, તેને બહુ બળતરા ઊભી થાય. તે સહન થાય નહીં, તેથી વિષયમાં પડે છે.

### પરિણામ પોતાને જ બોગવતું પડે !

આ લોકોને તો પાછું કશું ભાન ના હોય ને ! અને હરૈયા જેવા હોય. હરૈયા એટલે તમે સમજ્યા ને ? તમે હરૈયા કોઈને જોયેલા ? હરૈયું એટલે જેનું હાથમાં આવે, તેનું ખાઈ જાય. આ ભેંસ-બંધુને તમે ઓળખો કે ? એ બધાં ખેતરોનું ચોખ્યું જ કરી આપે. આમ આ હરૈયા પાડા જેવું જગત છે. અભ્યાસ, મૂળા તને વિચાર ના આવ્યો કે તારે ય બહેન, દીકરી છે. તું બીજી જગતાએ લે છે, તો તેના ફળ રૂપે તારું આ જશે. તમે જેવો ધક્કો મારો છો, તેવું પરિણામ ઊભું થશે. આ જગત બગાડવા જેવું છે નહીં. બગડી ગયું હોય તો એને સહન કરી લેવું. ફરી નવેસરથી બગાડવું નહીં. આ તો હરૈયા ઠોર ને જે આવ્યું તે ખાઈ જાય એટલે લોક પછી પોતાની છોડીઓને ખાઈ જાય. એની લોકને કંઈ પડેલી નથી. આવું જો બધા હરૈયા થાય તો શું રહ્યું ?

બનતાં સુધી જેને બ્રહ્મચર્ય પાળવાનું છે, જેને મોક્ષ જોઈએ છે, તે સ્ત્રીઓએ પુરુષોનો પરિચય ઓછામાં ઓછો કરવો, ના છૂટકે જ. જેને મોક્ષ જવું છે, એણે એટલી કાળજી લેવી જોઈએ. એવું તને લાગે છે કે નહીં લાગતું ? તને કેમ લાગે છે ? તો એની જોડે આપણે સમભાવે રહેવાનું, તે ઘડીએ તારી જાગૃતિ રહેવી જોઈએ. તે ઘડીએ ભાન ના ભૂલી જવું જોઈએ.

### સામો શાને સહે ?!

પ્રશ્નકર્તા : મારો સ્વભાવ, મારા વચન કડક છે. કોઈને પણ ચોંટી જાય, દુઃખ લાગી જાય. મને એવું ના હોય કે હું એને દુઃખ લગાડવા બોલું છું.

દાદાશ્રી : દુઃખ થાય એવું ના બોલવું જોઈએ. કોઈ જીવને દુઃખ થાય એવી વાણી બોલવી એ મોટો ગુનો છે.

પ્રશ્નકર્તા : આ વાણી એવી હોવાનું કારણ શું ?

દાદાશ્રી : રોક પાડવા હારું ! બીજા ઉપર રોક પડી જાય ને, એટલાં હારુ.

પ્રશ્નકર્તા : આપણો રોક પાડવા માટે કડક બોલ્યા અને સામેવાળો માણસ સહન કરી લે છે. એ સહન કરે છે, એ શેના આધારે સહન કરે છે ?

દાદાશ્રી : એક તો, એને ગરજ હોય, ગરજવાળો સહન કરે. બીજું, કકળાટ ના કરવા હારું સહન કરે. ત્રીજું, આબરૂ ના જાય તેટલા હારું સહન કરી લે. કૂતરું ભસે પણ આપણે નથી ભસવું, એવા ગમે તે રસ્તે ચલાવી લે, નભાવી લે લોકો.

લોકો ચાર ગાળો ખાય છે ખરાં, પણ બીજ અવળાં નાખે છે. પછી પાંચ ગાળ એને ભાડી. અભ્યાસ, ચાર તો સહન થતી નથી. પણ પાછા પાંચ ધીર્યા ! આ ચાર જમે કરી દે ને !! તારે જો સહન ના થતી હોય તો પાછી ફરી ધીરે છે શું કરવા ??

## આક્ષેપો આપવાથી ઊભો સંસાર !

આ કાળની વિચિત્રતા છે કે ઘરનાં માણસો જ સામસામી આરોપ આપે કે તમે આમ કરી નાખ્યું, તમે આમ કરી નાખ્યું. અદ્યા ભઈ, મેં નથી કર્યું આ. તો એ કહેશે કે ના, તમે જ કરી નાખ્યું છે. એટલે નફો આવે ને ત્યાં સુધી શેઠને ‘આવો શેઠ આવો શેઠ’ કરે. અને ખોટ જાય ત્યારે, તમે જ ઉંઘું બગાડું, તમે આમ કર્યું. તમારામાં અક્કલ નથી, આમ બધાં આક્ષેપો આપ આપ કર્યા કરે. તે વખતે કડવું ઝેર જેવું લાગે. પછી મનમાં આંટી રાખે કે મને સપડાવ્યો અને મારી પર આક્ષેપ આપે છે, પણ એ મારા લાગમાં આવે તો હું એની પર આપીશ. તે વખત આવે ત્યારે પેલો આની પર આક્ષેપ આપે ને પાછું વેર વાળે. એટલે જયારે આપણો સપડાઈ ગયા હોઈએ ને ત્યારે એણે આપણને આક્ષેપ આસ્થા હોય, ત્યારે આપણે સહન કરી લઈએ. પણ ફરી એ લાગમાં આવે ને, એ સપડાય ત્યારે પાછા આપણે એને આક્ષેપ આપીએ. એવી રીતે આ સંસાર ઊભો રહેલો છે.

## સંયોગોની ફસામણમાં કામ કાઢી લેવું !

ખોટું તો કશું હોતું નથી. પણ સહન ના થાય માણસને. છોકરાં કે વહુ ભૂલ દેખાડે તે માણસથી સહન થાય નહીં.

હા. એ કહે, સૂઈ રહો છાનાંમાનાં. એ તો બહુ બોલીએ ત્યારે કહેશે, તમારામાં સમજણ નહીં ને વગર કામનાં બોલ બોલ કરો છો ! એટલે થઈ રહ્યું, આવી રહ્યું એ બધું સહન કરવું પડે. એનાં કરતાં આપણે પોતાનું હોય ત્યાં રહેવું નિરાંતે ! આપણે તો નાના થઈને કામ કાઢી લેવું. બાબાને બે વખત કહીએ કે અદ્યા, પેલું લાવ, પેલું લાવ. ત્યારે એ પટિયાં પાડતો હોય તો આપણે તરત જાતે ઊઈને લેવું. છોકરા કહેશે કે રહેવા દો, રહેવા દો. ત્યારે આપણે કહીએ, ના, હું લઈ લઉં છું. એમ કહીને

કામ કાઢી લેવું. આપણે તો આ સંયોગો જોડે સંયોગ પૂરા કરવાનાં છે, આ સંયોગોમાં આવી ફસાયા છીએ, તો આ સંયોગો જેમ તેમ કરીને ઊંચા મૂકવાના છે. આપણે તો ધરી થવા માટે નથી આવ્યા, બાપા થવા નથી આવ્યા, આ તો સંયોગોને ઊંચા મૂકવાના છે, ઉકેલ લાવવાનો છે.

## ઉપકાર માનીને છોડવા હિસાબો !

બધું સહન કરવું પડે એ તો. એ ગોદા મારવા આવ્યો હોય ને, તો ગોદા ખાવા પડે આપણને. એવું છે ને, એ ઋણાનુંબંધ કેવું બાંધેલું ? જે પ્રેમથી બંધાયેલું હોય તે આનંદ આપે અને બીજી રીતે બંધાયેલું હોય તે ગોદા મારે. એટલે આપણે ગોદા ખાવાં જ પડે, છૂટકો જ નહીં ને. એટલે સમભાવે નિકાલ કરવાનો. કારણ કે આપણે છૂટા થવું છે. એને કંઈ પડેલી નથી. એ તો બાથંબાથ કરવા તૈયાર છે. આ તમારા પક્ષનો અને પેલા વિપક્ષી, પણ એવું મોઢે બોલીએ નહીં. મોઢે તો કહીએ કે ‘તારા વગર મને ગમતું નથી.’ એમ તેને કહેવું. નહીં તો સામાવળીયો થઈ જાય. પછી એને એમ લાગે કે આ છે જ એવા.

એને નિર્દ્દીષ તારે જોવા. એ તને અવળું બોલે તો ય તારે શાંતિ રાખવી, પ્રેમ સાચો હોવો જોઈએ. આસક્તિમાં તો છિ-બાર મહિનામાં પછી પાછું તૂટી જ જવાનું. પ્રેમ સહનશીલતાવાળો હોવો જોઈએ, એડજર્સ્ટેબલ હોવો જોઈએ.

સમજને ચાલો. હવે કોણ ચેતવે આવું ? અને ઋણાનુંબંધ, ચોપડે હિસાબ છે, તો પજવે તો ય સહન કરવું આપણે. પણ પજવીને પછી આપણને છોડતો હોય તો પાછું ફરી ત્યાં જવું ?

હા, દોષો કાઢે. જોણે મોટો કર્યો, જેનું એ કર્યું. તે બધાંનાં દોષો કાઢે. તે વખતે કેવી દશા થતી હશે ? કહીએનું અપમાન ના સહન કરેલું હોય ને તે વખતે છોકરો સામું બોલે તો શું થાય ?

## દાદાવાળી

માને પજવે તો ય એને આ વાલો લાગ્યા કરે અને બાપને સહન ના થાય, બાપને શી રીતે સહન થાય ? જ્યાં બુદ્ધિનું લાઈટ હોય. સ્ત્રીઓમાં ય બુધ્ધિ ખરી, પણ મોહ ખરો ને. તે મોહને લઈને અંધારું થયા કરે બુદ્ધિ પર અને આપણે પાછળ ફોકસ મૂકેલું હોય એટલે મુંજામણ થઈ જાય.

**કોઈના હાથમાં પજવવાની યે સત્તા નથી.** ને **કોઈના હાથમાં સહન કરવાની યે સત્તા નથી.** આ તો બધાં પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યાં છે. તે આપણે પ્રતિકમણ કરીએ એટલે પૂતળાં એની મેળે સીધાં થઈ જાય.

**પ્રશ્નકર્તા :** આપણને સહન કરવું પડે છે, તો એનો રસ્તો શો ?

**દાદાશ્રી :** આપણે તો સહન કરી જ લેવું, ખાલી બૂમ-બરાડો નહીં પાડવો. સહન કરવું તે પણ પાછું સમતાપૂર્વક સહન કરવું. સામાને મનમાં ગાળો ભાંડીને નહીં, પણ સમતાપૂર્વક કે ભર્ય, તે મને કર્મમાંથી મુક્ત કર્યો. મારું જે કર્મ હતું, તે મને ભોગવડાયું અને મને મુક્ત કર્યો. માટે એનો ઉપકાર માનવો. એ સહન કંઈ મફત કરવું પડતું નથી, આપણા જ દોષનું પરિણામ છે.

### સહેવું પડે એની જ ભૂલ !

**પ્રશ્નકર્તા :** દાદા, નાનપણથી જ બધી તરફથી મને માર પડ પડ કરે છે. હવે છોકરાંઓ તરફથી ય સહેવું પડે છે તે હવે કેવી રીતે સહેવું ? આમાં કોણી ભૂલ ?

**દાદાશ્રી :** આ ચાનો ઘાલો તમારી જાતે ફૂટે તો તમને દુઃખ થાય ? જાતે ફોડો તો તમારે સહન કરવાનું હોય ? અને જો તમારા છોકરાથી ફૂટે તો દુઃખ અને ચિંતા-બળતરા થાય. પોતાની જ ભૂલોનો હિસાબ છે એમ જો સમજાય તો દુઃખ કે ચિંતા થાય ? આ તો પારકાંના દોષ કાઢીને દુઃખ કે ચિંતા ઊભી કરે છે ને રાત-દહાડો નરી બળતરા જ ઊભી

કરે છે અને ઉપરથી પોતાને એમ લાગે છે, કે મારે બહુ સહન કરવું પડે છે.

વાઈફી તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુઃખે, તો તે તમારી ભૂલ. જે સહન કરે તેની ભૂલ, એમ વીતરાગ કહે છે અને આ લોકો નિમિત્તને બચકાં ભરે છે !

### સ્વરૂપજ્ઞાન જગૃતિના પરિણામ !

‘સ્વરૂપનું જ્ઞાન’ એવું છે, કે જેમ પરિણામ પામે તેમ કશું જ સહન ના કરવું પડે. જ્ઞાતા-જ્ઞેય સંબંધથી સહન ના કરવું પડે. તારી જોઈ કોઈ અથડાયો કેમ ? એ જ તારો દોષ છે. આપણા દોષે જ બંધન છે. પોતાની ભૂલથી છૂટવાનું છે. આ તો સંયોગ સંબંધ છે. હિસાબ વગર કોઈ ભેગો ના થાય. બધું પોતાના દોષથી બંધાયેલું છે. માત્ર પોતાના દોષ જો જો કરવાથી છૂટું થવાય તેમ છે. આ અમે અમારા દોષ જો જો કર્યા, તે અમે છૂટ્યા. નિજદોષ સમજાય એટલે છૂટો પડતો જાય.

પોતાના હાથે પાંચસો રૂપિયા પડે તો સહન કરી શકાય. એમ જ પોતાની ભૂલો સમજાય એટલે સહન કરવાની શક્તિ એની મેળે આવે.

લોકો સહનશક્તિ વધારવાનું કહે છે, પણ તે ક્યાં સુધી રહે ? જ્ઞાનની દોરી તો ઠેઠ સુધી પહોંચે. સહનશક્તિની દોરી ક્યાં સુધી પહોંચે ? સહનશક્તિ લીમિટવાળી છે, જ્ઞાન અનલિમિટેડ છે. આ અમારું જ્ઞાન જ એવું છે, કિચિત્તમાત્ર સહન કરવાનું રહે નહીં. સહન કરવું એ તો લોખંડને આંખથી જોઈને ઓગાળવું એટલી શક્તિ જોઈએ. જ્યારે આ જ્ઞાનથી કિચિત્તમાત્ર સહન કર્યા વગર પરમાનંદ સાથે મુક્તિ ! પાછું સમજાય કે આ તો હિસાબ પૂરો થાય છે ને મુક્ત થવાય છે !

### નમન નમનમાં ફેર !

**પ્રશ્નકર્તા :** આ બોસને નમીએ છીએ એટલું

**દાદાવાળી**

જો ભગવાનને નમીએ તો ય કલ્યાણ થઈ જાય.

**દાદાશ્રી :** હા, કલ્યાણ થઈ જાય. એટલું ભગવાનને નમસ્કાર કરીએ તો ય ઉકેલ આવી જાય, કારણ કે ભગવાનને ઘેર ખોટ નથી. લોકોને બોસને નમવાનું ગમતું નથી, પણ એક બાજુ સંસાર ચલાવવો પડે છે અને એ ફરજિયાત છે ને ! તે શું કરે ?! એટલે બોસને નમીને, કામ કરીને, બે અવળા-સવળા બોલ સહન કરી લઈને ચલાવવું પડે. બોસ ઘેરથી ચિંઠાઈને આવ્યો હોય, તે આપણી ઉપર પડા ચિંઠાયા કરે.

**... આ તો આવતો ભવ બગાડયો !**

પણ આપણા લોકો સહન કરીને પણ બોલતાં નથી. પણ મનમાં ને મનમાં ગાળો ભાડે કે ‘આ નાલાયક અહીં ક્યાં આવ્યો ?’ ભગવાને કહ્યું છે એનાં કરતાં ચોખ્યું બોલ્યો હોત તો સારું. આ મન એટલે આવતા ભવનું ચિત્ર ! તે આ લોકો આવતો ભવ બગાડે છે. અને અહીં મોંઢે બોલ્યો હોત તો આ ભવમાં અને પેલો મારમાર કરત, અગર તો વગોવત. પણ આ ભવમાં હિસાબ ચોખ્યો થઈ જાત. અને મનમાં ઊંધું વિચાર્યું તે તો આવતા ભવનું બધું બગાડ્યું. હવે પેલાં ચાર દહાડા રહે તો ત્યાં સુધી મનમાં આ ક્યારે જરો ? ક્યારે જરો ? થયા કરે ને રાતે પોતે ઊંઘે પણ નહીં ને પેલા તો નિરાંતે ઊંઘી ગયા હોય !

**વાળીને રેકર્ડ જાણો !**

ઘરના કે બહારના કડવું બોલે તે સહન ના થાય, તેથી અમે કહ્યું કે વાણી એ ‘રેકર્ડ’ છે. આ કાળમાં ‘રેકર્ડ’ વાંકી વાગે છે. સામાની ગમ્યે તેટલી ગમ્યે તેવી ‘રેકર્ડ’ વાગતી હોય પણ આપણે ‘રેકર્ડ’ સ્વરૂપે સાંભળ્યા કરીએ ને સામો કંટાળો ત્યારે જાણવું કે ખરું જ્ઞાન પચ્યું છે. કષાય કોઈ દહાડો કષાયથી જીતાય નહીં, કષાય સમતાથી જ જીતાય.

અજ્ઞાન દશામાં એમ લાગે કે ‘આ મને આવું

કહે કહે કરે છે તે મારાથી શી રીતે સહન થાય ?’ ત્યાં સુધી રોગ ઓછા થાય નહીં. આપણે સહન કરવાનું જ નથી. માત્ર સમજ જવાનું છે કે આ રેકર્ડ છે. જો તમે વાણીને રેકર્ડ સ્વરૂપ નહીં માનો તો તમારી વાણી એવી જ નીકળવાની. એટલે કાર્ય-કારણ, કાર્ય-કારણ ચાલુ જ રહેશે.

**કાંટો વાગે તેમાં કોનો વાંક ?**

**પ્રશ્નકર્તા :** દાદા, કોઈ કડવા શબ્દો કહે તો તે સહન નથી થતા, તો શું કરવું મારે ?

**દાદાશ્રી :** જો તેનો તને ખુલાસો કરું. આ રસ્તા વચ્ચે કાંટો પડ્યો હોય ને હજારો માણસો નીકળે પડા કાંટો કોઈને વાગે નહીં. પણ ચંદુભાઈ જાય તો કાંટો આડો હોય તો ય એવો વાગે કે પંજામાંથી સૌંસરો ઉપર આવે ! કડવાનો સ્પર્શ થવો એ હિસાબી હોય છે. અને કડવાનો સ્પર્શ થાય તો માનવું કે આપણા કડવાની રકમમાંથી એક ઓછી થઈ. જેટલું કડવું સહન કરશો એટલાં કડવાં તમારા ઓછાં થશે. મીઠું પણ સ્પર્શ થાય ત્યારે એટલું ઓછું થાય છે. પણ આ કડવું સ્પર્શ થાય છે ત્યારે નથી ગમતું, આ ઓછું થાય છે તો ય કડવું કેમ નથી ગમતું ? પેલાને કહીએ કે કડવું ફરી આપને ? તો ય એ ના આપે. આ તો કોઈના હાથમાં સત્તા જ નથી. બધું જ ગણતરીબંધ છે, સિલક સાથે છે, કશું ગપ્પું નથી. મર્યાદાસુધીનું બધું જ ગણતરીબંધ છે. આ તો હિસાબ પ્રમાણે હોય કે આના તરફથી ૩૦૧ આવશે, પેલા પાસેથી ૨૫ આવશે, આની પાસેથી ૧૦ આવશે. ‘જ્ઞાન’ જો હાજર રહેતું હોય તો કશું જ સહન કરવું ના પડે. આ તો બધું રિલેટિવ રિલેશન છે. કડવું મીઠું બધું જ હિસાબથી મળે છે. રોજ કડવું આપનાર એક દા’ડો એવું સુંદર આપી દે છે ! આ બધાં ઋણાનુંબંધી ઘરાક-વેપારીના સંબંધો છે !

**ના પોષાય તો ધીરશો નહીં !**

કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ

## દાદાવાળી

થાય કે ‘આ મને કેમ અવળું બોલે છે ?’ એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો, તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી, તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે પાંચ નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી પાંચ ધીરી તે નવી ધીરધાર કરે છે ને પછી ગુંચાયા કરે છે. આમ ગુંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુદ્ધિ શી રીતે પહોંચે ?

જો તારે આ વેપાર ના પોખાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં, ને આ પોખાતું હોય તો ફરી પાંચ આપ.

એટલે કોઈ બે ગાળો ભાંડી જાય તો શું કરવું જોઈએ ? જમે કરી દેવાનું. પૂર્વ આપેલી છે તે પાછી આપી ગયો છે અને જો ગમતી હોય બે ગાળો, તો બીજી પાંચ ધીરવી અને ના ગમતી હોય તો ધીરવી કરવી નહીં. નહીં તો પાછી આપતી વખતે સહન નહીં થાય. માટે જે જે ધીરે એ જમે કરવું.

### કોધના આલોચના-પ્રતિકમણ-પ્રત્યાખ્યાન !

**પ્રશ્નકર્તા :** આપણાથી કોધ થઈ જાય ને ગાળ બોલાઈ જાય, તો કેવી રીતે સુધારવું ?

**દાદાશ્રી :** એવું છે ને કે આ જે કોધ કરે છે, ગાળ બોલે છે, એ કંદ્રોલ નથી પોતાની જાત ઉપર એટલે આ બધું થાય છે. કંદ્રોલ રાખવા માટે પહેલા કંઈક સમજવું જોઈએ. કો'ક કોધ કરે આપણી ઉપર, તો આપણાને સહન થાય છે કે નહીં, એ જોવું જોઈએ. પોતે કોધ કરીએ, તે પહેલાં આપણી ઉપર કોઈ કરે એવું, તો આપણાને સહન થાય, ગમે કે ના ગમે ? આપણાને જેટલું ગમે એટલું જ બીજા જોડે વર્તન કરવું.

પહેલા તો દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો, ક્ષમા રાખો એવો ઉપદેશ શીખવાડે. ત્યારે આ

લોક શું કહે છે, ‘અલ્યા, મને કોધ આવ્યા કરે છે ને તું કહે છે કે ક્ષમા રાખો, પણ તે મારે કર્ય રીતે ક્ષમા રાખવી ?’ એટલે આમને ઉપદેશ કેવી રીતે આપવાનો હોય કે તમને કોધ આવે તો તમે આવી રીતે, મનમાં પસ્તાવો લેજો કે મારામાં શી નબળાઈ છે કે મારાથી આવો કોધ થઈ જાય છે. તે ખોટું થઈ ગયું મારાથી, એવો પસ્તાવો લેજો અને માથે કોઈ ગુરુ હોય તો એમની હેઠલ્ય લેજો અને ફરી એવી નબળાઈ ઉત્પન્ન ના થાય એવો નિશ્ચય કરજો. તમે હવે કોધનો બચાવ ના કરો, ઉપરથી તેનું પ્રતિકમણ કરો.

મહી ઘુમાય તે ય કોધ છે. આ સહન કરવું, એ તો ડબલ કોધ છે. સહન કરવું એટલે દબાવ દબાવ કરવું તે, એ તો એક દહાડો સ્વીંગ ઊછળે ત્યારે ખબર પડે. સહન શા માટે કરવાનું ? આનો તો જ્ઞાનથી ઉકેલ લાવી નાખવાનો. ઉદરડે મૂઢ્યો કાપી તે ‘જોવાનું’ અને ‘જાણવાનું’ તેમાં રડવાનું શાને માટે ? આ જગત જોવા-જાણવા માટે છે !

### અપમાન સહેતું એ જ બળવાનપણું !

અપમાન કરે તો ય વાંધો નહિ તને ? એટલી સહનશીલતા છે ??

**પ્રશ્નકર્તા :** તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું, તો એ નિર્બળતા ના કહેવાય ?

**દાદાશ્રી :** ના.. ઓહોહો ! અપમાન સહન કરવું, એ તો મહાન બળવાનપણું કહેવાય !! અત્યારે અમને કોઈ ગાળો ભાડે તો અમને કશું જ ના થાય, એને માટે મન પડા ના બગડે, એ જ બળવાનપણું ! અને નિર્બળતા તો, આ બધા કચ્ચકચ કર્યા જ કરે છે ને, જીવમાત્ર લઘ્મલઘા કર્યા કરે છે, એ બધી નિર્બળતા કહેવાય. એટલે અપમાન શાંતિથી સહન કરવું એ મહાન બળવાનપણું છે અને એવું અપમાન એક જ ફેરો ઓળંગળીએ, એક સ્ટેપ ઓળંગને, તો સો સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે. આપને સમજાયું ને ? સામો બળવાન હોય, એની

## દાદાવાળી

સામે નિર્બળ તો જીવમાત્ર થઈ જ જાય છે, એ તો એનો સ્વભાવિક ગુણ છે. પણ જો નિર્બળ માણસ આપણને છંછેડે તો ય એને આપણે કંઈ પણ ન કરીએ ત્યારે એ બળવાનપણું કહેવાય. ‘જ્ઞાની પુરુષ’ પાસે તો એટલી બધી સિદ્ધિઓ હોય કે સામાને આશ્રય કરી નાખે એક જ વિધિ કરીને, પણ એવું ના કરાય. સિદ્ધિ તો એ વાપરે જ નહીં ને !

### અપમાન, ત્યારે જડે સાર સંસારનો !

એક ફેરો અપમાન થાય તે હવે અપમાન સહન કરવાનો વાંધો નથી, પણ અપમાન લક્ષમાં રાખવાની જરૂર છે કે શું આ અપમાનને માટે જીવન છે ? અપમાનનો વાંધો નથી, માનની ય જરૂર નથી ને અપમાનની ય જરૂર નથી. પણ આપણું જીવન શું અપમાનને માટે છે ? એવું લક્ષ તો હોવું જોઈએને ?

આ તો કહેશે, ‘આણો મારું અપમાન કર્યું’ ! મેલને છાલ. અપમાન તો ગળી જવા જેવું છે. ધણી અપમાન કરે, ત્યારે યાદ આવવું જોઈએ કે આ તો મારા કર્મનાં ઉદ્ય ફરે, ત્યારે ધણી ‘આવો, આવો’ કરે છે. માટે આપણે મનમાં સમતા રાખીને ઉકેલ લાવી નાખવો. જો મનમાં થાય કે મારો દોષ નથી છતાં મને આમ કેમ કર્યું, એટલે પછી રતે ત્રણ કલાક જાગો ને પછી થાકીને સૂઈ જાય.

### અપમાન અડયું એ જ માની !

હવે એક ભાઈ એ માન સ્વીકાર નહીં કરતા હોય એટલે પારો ના ચઢે. પણ પછી મેં કર્યું, ‘તમારામાં માન નથી રહ્યું ને ? તે હવે થર્મોમિટર મૂકો કે ભઈ, તાવ ચઢ્યો કે ઊતર્યો ?’ ત્યારે એ કહે છે, ‘એ શું થર્મોમિટર ?’ મેં કર્યું, ‘હમણે પંદર-વીસ જણ સગાવહાલાં બેઠાં હોય, અને તમને કહે કે ‘તમારામાં જરાય છાંટો ય અક્કલ નથી.’ એ અસર થઈ ગઈને ! અત્યા, ક્યાં ગયું ? તારું માન નહોતું ને ? અપમાન જેવું માન નથી કોઈ. પેલા માનની તો કિમત જ નથી. પણ અપમાન જેવું કોઈ માન

નથી. અપમાન જેનાથી સહન નથી થતું એ જ મોટો માની. પેલા લોકો આપે એ માન તો સહન થઈ શકે. જ્યારે અપમાન સહન નથી થતું એ મોટામાં મોટું માન છે. એ મોટો માની કહેવાય. મારી પાસે થર્મોમિટર બધી જાતાં છે. કોઈ પણ આવ્યોને, તો હું થર્મોમિટર મૂકી દઉં. થર્મોમિટર વસ્તુ એવી છે કે તરત ઘ્યાલમાં આવી જાય.

### અપમાન ડિગેન્ટ્વ કરવાની રીત !

અપમાન સહન કરવાની શક્તિ આવશે, એ માન જશે ત્યારે. કોથ એ ગુરખો છે. ‘માને’ આ ગુરખો રાખેલો છે કે જો અપમાન કરવા આવે તો તેને કહે, ‘તેલ કાઢી નાખજે.’ અને પેલો એક લોબ છે, તેણે ય એક ગુરખો રાખ્યો છે. તે કપટ રાખ્યો છે. એને જ માયા કહી. અને લોબ જતો રહે તો એ માયા જતી રહે. કોથ છે એ માનનો ગુરખો. ‘મૂરખ છો, અક્કલ વગરના છો’ એવું કોઈક કહ્યું હોય ત્યારે આપણે કહેવું, ‘ભઈ, હું આજનો નથી, પહેલેથી જ એવો છું.’ એમ કહેવું.

### અપમાન કરનારો, માનો ઉપકારી !

**પ્રશ્નકર્તા :** હવે તો આ માન-અપમાન બહુ ખૂંચે છે, એમાંથી મુક્ત થવું કરી રીતે ?

**દાદાશ્રી :** અપમાન ખૂંચે છે કે માન ખૂંચે છે ?

**પ્રશ્નકર્તા :** આમ તો અપમાન.

**દાદાશ્રી :** અરે, બધ્યું માન પણ બહુ ખૂંચે. જો માન પણ વધારે પડતું આપે ને, તો માણસ ઉભો થઈ જાય. માન બહુ આપે ને, તો ત્યાંથી કંટાળીને નાસી આવે માણસ. રોજ આખો દહાડો માન આપ આપ કરે ને, તો ત્યાંથી માણસ કંટાળીને નાસી જાય. અને અપમાન તો ઘડીવારે ય ગમે નહીં. માન તો થોડીક વાર ગમે ય ખરું. છતાંય માણસ અપમાન સહન કરી શકે, માન સહન નહીં કરી શકે. હા, માન સહન કરવું એ તો બહુ સીસું પીધા જેવું છે. છોકરો

## દાદાવાળી

પૈણવાનો થાય ને, તે બાપને નીચો નમીને પગે લાગે ત્યારે બાપ ઊભો થઈ જાય, ઊંચો થઈ જાય. ‘અભ્યા, તું કેમ હાલે છે ?’ ત્યારે એ કહે, ‘સહન થતું નથી.’

**પ્રશ્નકર્તા :** અને છતાં અપમાન ના ગમે, તે કેવું કહેવાય ?

**દાદાશ્રી :** અપમાન ના ગમે, એ તો બહુ જ ખોટું કહેવાય. અપમાન તો ના ગમે અને એ તો આપણા બધાય લોકોને અપમાન નથી ગમતું. એ ગમડવાની શક્તિ લોકોને ઉત્પન્ન થઈ નથી. એમણે તો અપમાન કરનારો ભાડે રાખવો જોઈએ. પણ કોઈ ભાડે રાખતું જ નથી ને ! પણ ભાડાવાળો અપમાન સાચું કરે નહીં ને ! અને લોક તો, જ્યારે સાચું અપમાન કરે છે ત્યારે એ બેસી જાય છે. સાચું અપમાન કરે એને ઉપકારી ગણવાનો. પણ ત્યારે માણસ બેસી જાય છે. સાચું અપમાન કરે ત્યારે બેસી જવાય નહીં. એટલે સામો કોઈક અપમાન કરનાર મળી આવે ને, તો બહુ ઉપકારી માનીને ‘એ જોડે ને જોડે રહે તો બહુ સારુ’ એવું નક્કી કરજો.

**સહન કરે, તેમ સ્રીંગ છટકે !**

આ અમને બુદ્ધિ નહીં એટલે પછી અમને વફાડ ના થાય ને. અને તું તો બુદ્ધિવાળો માણસ. રોફવાળો માણસ. અને તું તો પાછું સહન કરે. એટલે વધારે કૂદવાનું.

**પ્રશ્નકર્તા :** રોફવાળો બહુ સહન કરે ?

**દાદાશ્રી :** ને સહન કરે છે ને, એટલે સ્થ્રીંગ વધારે કૂદે છે. જ્યારે કૂદે છે ત્યારે વધારે કૂદે. એ છેલ્લે એક દહાડે તું આખુંય કેક પાડી દે. તે બાર ઈંચ પહોળી કેક. એટલે સિમેન્ટથી ય પૂરી ના થાય એવી ! એટલે એવું સહન કરવાનું ના હોય. વિચારવાનું હોય કે આ કહ્યું, તો આમાં કોની ભૂલ છે ? ભોગવે એની ભૂલ, કહીને આપણે માથે લઈએ તો ઉકેલ આવે. તારે કોઈ દહાડો ભોગવવું નથી પડતું ?! ને ભોગવવું પડે, તો આપણે સમજાએ કે

આ મારી જ ભૂલ છે.

સહનશક્તિ ઈજ ધી મધર ઓફ ઈગોઈઝ !  
સહનશીલતા એ અહંકારનો ગુણ છે.

‘એક્ઝેક્ટલી’ જે સહન કરે છે, તે ‘કેસ’ કુદરતને સૌંપે છે. કોઈને ય દંડ આપવાની જરૂર નથી. કુદરત જ તેને દંડ આપશે.

મને સહન નથી થતું એ જ અસહનશક્તિ ને  
મને સહન થાય છે એ જ સહનશક્તિ.

**જેનું અપમાન, તે ‘પોતે’ જ્યોય !**

આ ‘ચંદુભાઈ’નું કોઈક અપમાન કરે તો શું થાય ? રાતે ઊંઘ ના આવે ને ? જાટકા વાગે ! આમ ક્ષત્રિય પ્રજાને, તે જાટકા વાગે. પેલો અપમાન કરનારો ઊંઘી ગયો હોય, પણ આ જાટકાવાળો ના ઊંઘે ! કોઈ અપમાન કરે ને આપણને ઊંઘ ના આવે એવું શા કામનું તે ? એવી નિર્બંધતા શું કામની તે ? કોઈક અપમાન કરે ને આપણે શું કામ ના ઊંઘીએ ? અને કો’કનું અપમાન થાય છે, તમારું થતું જ નથી. ‘તમારું’ અપમાન કરે તો સહન ના જ કરવું જોઈએ. પણ એ ‘તમારું’ અપમાન નથી કરતો. તો શું કરવા આમ હાય હાય કરો છો ? આ તો કોઈકનું અપમાન થાય છે ને ‘તમે’ માથે લઈ લો છો. ‘મને કર્યુ’ એવું તો ના હોવું જોઈએ ને ?! હા, ‘તમારું’ અપમાન ના કરવું જોઈએ કોઈએ. પણ ‘તમારું’ અપમાન કોઈ કરે ય નહીં. તમને ઓળખે જ શી રીતે ? ‘તમને’ તો કોઈ ઓળખતું જ નથી ને ! ઓળખે તો ‘ચંદુભાઈ’ને ઓળખે. એ ‘આપણને’ તો ઓળખતો જ નથી ને !

**આસમજાથી સહન, ત્યાં સ્રીંગ ઉછટે !**

**પ્રશ્નકર્તા :** કેટલા વખત આમ આપણે સહન કરવું જોઈએ ?

**દાદાશ્રી :** સહન કરવાથી તો શક્તિ બહુ વધે.

**પ્રશ્નકર્તા :** એટલે સહન જ કર્યા કરવું એમ ?

## દાદાવાળી

**દાદાશ્રી :** સહન કરવા કરતાં એની ઉપર વિચારવું સારું છે. વિચારથી એનું સોલ્યુશન લાવો. બાકી સહન કરવું એ ગુનો છે. બહુ સહનશીલતા થાયને તે સ્ત્રીઓની પેઠ ઊછળે પછી તે આખું ઘર બધું બેદાન-મેદાન કરી નાબે. સહનશીલતા તો સ્ત્રીઓ છે. સ્ત્રીઓ ઉપર લોડ નહીં મૂકવો કોઈ દહરો ય. એ તો ઢીક છે થોડા પૂરતું હવે રસ્તામાં કો'કની જોડે જતાં-આવતાં એ થયું હોય, ત્યાં જરાક એ સ્ત્રીઓ વાપરવાની છે. અહીં ઘરના માણસો ઉપર લોડ મૂકાય નહીં. ઘરના માણસોનું સહન કરું તો શું થાય ? સ્ત્રીઓ કૂદે એ તો.

### સમજણપૂર્વક સહન, ત્યાં સોલ્યુશન !

**પ્રશ્નકર્તા :** સહનશીલતાની લિમિટ કેટલી રાખવાની ?

**દાદાશ્રી :** એને અમુક હદ સુધી સહન કરવું. પછી વિચારીને એણો તપાસ કરવી કે શું છે આ હકીકતમાં. વિચારશો એટલે ખબર પડશો કે આની પાછળ શું રહેલું છે ! એકલું સહન કર કર કરશો તો સ્ત્રીઓ કૂદશે. વિચારવાની જરૂર છે. અવિચારે કરીને સહન કરવું પડે છે. વિચારો તો સમજશો કે આમાં ભૂલ ક્યાં થાય છે. એ બધું એનું સમાધાન કરી આપશે. મહી અંદર અનંતશક્તિ છે, અનંતશક્તિ. તમે માંગો એ શક્તિ મલે એવી છે. આ તો અંદર શક્તિ ખોળતો નથી ને બહાર શક્તિ ખોળે છે. બહાર શું શક્તિ છે ?

### સમજવાથી સોલ્વ પરિષા

ઘેર ઘેર ભડકા સહન કરવાથી જ થાય છે. હું કેટલું સહન કરું, મનમાં એમ જ માને છે. બાકી વિચારીને રસ્તો કાઢવો જોઈએ. જે સંજોગો બાળયા છે, જો સંજોગો કુદરતનું નિર્માણ છે અને તું હવે શી રીતે છટકી નાસીશ ? નવા વેર બંધાય નહીં અને જૂનાં વેર છોડી દેવાં હોય તો, એનો રસ્તો કાઢવો જોઈએ. આ અવતાર વેર છોડવા માટે છે. અને વેર

છોડવા માટેનો રસ્તો છે, દરેક જોડે સમભાવે નિકાલ ! પછી તમારા છોકરાઓ કેવાં સારા સંસ્કારી થાય ! એટલે હું શું કહું છું, સહન ન કરતાં, સમજો. સમજો તો બધું ઉકેલ આવી જાય. આ પરિષા સોલ્વ થાય એવું છે. આ હું સોલ્વ કરીને બેઠો તો તમને સોલ્વ કરવાનું બધું દેખાડી દઈશ.

### ભૂલો સમાવી લે સાગર જયમ !

**પ્રશ્નકર્તા :** ‘દાદા’, વ્યવહારમાં મોટો નાનાની ભૂલ કાઢે, નાનો એનાથી નાનાની ભૂલ કાઢે વ્યૂ પોઈન્ટની અથડામણમાં, એ કેમ ?

**દાદાશ્રી :** આ તો એવું છે કે મોટો નાનાને ખાઈ જાય. તે મોટો નાનાની ભૂલ કાઢે એના કરતાં આપણે કહીએ, મારી જ ભૂલ. ભૂલ જો માથે લઈ લઈએ તો એનો ઉકેલ આવે. અમે શું કરીએ ? બીજો જો સહન ના કરી શકે તો અમે અમારે જ માથે લઈ લઈએ. બીજાની ભૂલો ના કાઢીએ. તે શા હારુ બીજાને આપીએ ? આપણી પાસે તો સાગર જેવું પેટ છે ! જુઓને, આ મુંબઈની બધી જ ગટરોનું પાણી સાગર સમાવે છે ને ? ! તેમ આપણે ય પી લેવાનું. તેથી શું થશે, કે આ છોકરાંઓ ઉપર, બીજા બધાં ઉપર, પ્રભાવ પડશે. એ ય શીખશે. બાળકો ય સમજ જાય કે આમનું સાગર જેવું પેટ છે ! જેટલું આવે તેટલું જમે કરી લો. વ્યવહારમાં નિયમ છે, કે અપમાન કરનાર પોતાની શક્તિ આપીને જાય. તેથી અપમાન લઈ લઈએ હસતે મુખે !

જો આપણામાં વક્કર ના હોય તો ઘોડીને પંપાળ પંપાળ કરીએ તો ય એનો પ્રેમ આપણને ન મળે. પહેલો વક્કર પડવો જોઈએ. ‘વાઈફ’ની કેટલીક ભૂલો આપણે સહન કરીએ તો તેના પર પ્રભાવ પડે.

### અજ્ઞાનદશામાં બંધાય વેર !

આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે. માટે અથડામણ ટાળો, અથડામણથી આ જગત

## દાદાવાળી

ઉભું થયું છે. એને ભગવાને વેરથી ઉભું થયું છે, એમ કહ્યું છે. દરેક માણસ, અરે જીવમાત્ર વેર રાખે. વધુ પડતું થયું કે વેર રાખ્યા વગર રહે નહીં. તે પછી સાપ હોય, વીઠી હોય, બળદિયો હોય કે પાડો હોય, ગમે તે હોય પણ વેર રાખે. કારણ કે બધાનામાં આત્મા છે, આત્મશક્તિ બધાનામાં સરખી છે. કારણ આ પુદ્ગલની નભળાઈને સહન કરવું પડે છે. પણ સહન કરતાંની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું !

**પ્રશ્નકર્તા :** દાદા, અથડામણ ટાળવાનું આપે જે કહ્યું, એટલે સહન કરવું એમ અર્થ થાય ને ?

**દાદાશ્રી :** અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો ? સહન કરવું અને ‘સ્પ્રીંગ’ દબાવવી એ બે સરખું છે. ‘સ્પ્રીંગ’ દબાવેલી કેટલા દહાડા રહેશે ! માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, સોલ્યુશન કરવાનું શીખો.

અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે. પછી એક દહાડો ‘સ્પ્રીંગ’ ઉછળે તેમ બધું પાડી નાખે, પણ એ તો ફુદરતનો નિયમ જ એવો છે.

### જ્ઞાનદશાની સૂક્ષ્મ સમજ !

**પ્રશ્નકર્તા :** અથડામણ ટાળવાની ‘સમભાવે નિકાલ’ કરવાની આપણી વૃત્તિ હોય, છતાં સામો માણસ આપણાને હેરાન કરે, અપમાન કરે તો શું કરવું આપણે ?

**દાદાશ્રી :** કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો ‘સમભાવે નિકાલ’ કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું, અને આપણે આપણી મેળે આપણું ‘પંજલ’ ‘સોલ્વ’ કર્યા કરવું.

એવો જગતનો કાયદો જ નથી કે કોઈને લીધે આપણે સહન કરવું પડે. જે કંઈ સહન કરવાનું થાય

છે બીજાના નિમિત્તે, એ આપણો જ હિસાબ હોય છે. પણ આપણાને ખબર નથી પડતી કે આ ક્યા ચોપડાનો ને ક્યાંનો માલ છે, એટલે આપણે એમ જાણીએ કે આણો નવો માલ ધીરવા માંડયો. નવો કોઈ ધીરે જ નહીં, ધીરેલો જ પાછો આવે. આપણા જ્ઞાનમાં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનની કો’ક વાર તપાસ કરી લેવી કે સામો ‘શુદ્ધાત્મા’ છે. આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદ્યથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે. પછી આપણાને આ જ્ઞાન ઈટસેલ્ફ જ ‘પંજલ’ ‘સોલ્વ’ કરી આપે.

**પ્રશ્નકર્તા :** એનો અર્થ એમ થયો કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો તે પાછો આવ્યો એમ ને ?

**દાદાશ્રી :** એ પોતે શુદ્ધાત્મા છે ને આ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ આ ફળ આપે છે. આપણે શુદ્ધાત્મા છીએ, એ પણ શુદ્ધાત્મા છે. હવે બન્નેને ‘વાયર’ ક્યાં લાગુ થયો છે? આ પ્રકૃતિ ને તે પ્રકૃતિ, બન્ને સામસામી બધા હિસાબ ચૂકવે છે. એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદ્ય તે પેલો આપે કંઈક. માટે આપણે કહ્યું કે આ આપણા કર્મનો ઉદ્ય છે ને સામો નિમિત્ત છે, એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્યો થઈ ગયો. આ ‘સોલ્યુશન’ હોય ત્યાં પછી સહન કરવાનું રહે જ નહીં ને ?

સહન કરવાથી શું થશે ? આવો ફોડ નહીં પાડો, તો એક દહાડો એ ‘સ્પ્રીંગ’ કૂદશે. કૂદલી સ્પ્રીંગ તમે જોયેલી ? મારી ‘સ્પ્રીંગ’ બહુ કુદતી હતી. ઘણા દહાડા હું બહુ સહન કરી લઈ ને પછી એક દહાડો ઉછળે તો બધું જ ઉડાડી મુકું. આ બધું અજ્ઞાન દશાનું, મને એનો ખ્યાલ છે. એ મારા લક્ષમાં છે. એટલે તો હું કહી દઉં ને કે સહન કરવાનું શીખશો નહીં. એ અજ્ઞાનદશામાં સહન કરવાનું હોય. આપણે અહીં તો ફોડ પાડી દેવો કે આનું પરિણામ શું, એનું કારણ શું, ચોપડામાં પદ્ધતિસરનું જોઈ લેવું, કોઈ વસ્તુ ચોપડા બહારની હોતી નથી.

### બાધ તપ : આંતર તપ !

એવું છે, મોક્ષના ચાર પાયા - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. સમજ્યા વગર કેટલાક તેમાંનો એક તપનો જ પાયો જાલી પડ્યા. આ ખાટલાના ચાર પાયામાંથી એક પાયો જાલે એવું આ તપને જાલી પડ્યા. દેહને તપાવવાનો નથી, મનને તપાવવાનું છે અને એ પણ એવી રીતે કે બહાર કોઈ જાણે નહીં. પણ આજે તો બાધ તપ જ કરે છે, તે જે સ્ટેશન આવ્યું તે પકડયું. બાધ તપથી બાપજીને ફળ શું મળ્યું ? દેહ તેજવાળો થયો. દેહને તપવ્યો તે દેહ અજવાળાવાળો થાય, પણ દેહ જોડે આવવાનો છે ? એ તો બાળી મેલવાનો છે. આ દેહ છે ત્યાં સુધી પોતાનું જ કામ કાઢી લેવાનું છે. ત્યાગવાળાઓએ ત્યાગની કસરત કરી, આ બધી કસરતશાળાઓ છે. એમાં આત્મા માટે કંઈ જ થતું નથી, કંઈ જ ઉપકાર થતો નથી. બૈરી વગર જિવાય કે નહીં તેની કસરત કરી, તે બૈરી મૂકી નાસી જાય. બૈરી બાર મહિના પિયર નથી જતી ? માટે ઘેર પણ જિવાય છે, શું કામ નાસી જાય છે ? બા, દીકરાના બાપા જોડે રોજ વફવાડ કરતી હોય, તો દીકરો ગાંડ વાળે કે, ‘હવે આ ન હો, બૈરી ન હો,’ એવી મજબૂત વાળેલી ગાંડ પછી ઉદ્યમાં આવે, તે પછી નાસી જાય. એના કરતાં આ સહન કરને ! આ પ્રાપ્ત તપને સહન કરતાં કરતાં મોક્ષે જવાશે. પ્રાપ્ત દુઃખ એને તો ઈનામ કહેવાય. ભલે પછી એ સહન કરવું પડે, પણ કશું ગયું તો નથી ને ? આપણાને કશુંક મળ્યું એ ઈનામ જ કહેવાય ને ?

અને સરળ રીતે ઓછી મહેનતે. અને આનંદપૂર્વક પાછું. પેલાં તપ કરવાનાં તો કઠોર તપ કરવાનાં. એ સહન જ ના થાય. જોતાં જ ચીતરી ચેદે.

### ત્યાં હસતે મોઢે વધાવી લેવાં !

આ તપ કોઈનું શીખી લાવીને કરવા જેવું નથી. તારું મન જ રાત-દહરો તપેલું છે ને ! તારું

મન, વાણી અને વર્તન જે તપેલું છે તેને તું શાંત ભાવે સહન કર, એ જ ખરું તપ છે ! જ્યારે મન, વાણી અને વર્તન તપેલું હોય ત્યારે તેમાં તે વખતે તન્મયાકાર હોય, અને જ્યારે કશું તપેલું ના હોય ત્યારે તપ કરવા બેસે, પણ પછી તે વખતે શા કામનું ? તપ તો ક્યારે કરવાનું કહ્યું છે ભગવાને ? જ્યારે બધાં તેર આલનારાં આવે તે વખતે મહીં અંતર તપે તો ય સહન કરી લેવું; લાલ, લાલ હદ્ય થઈ જાય તો ય શાંત ભાવે સહી લેવું. તપને બોલાવી લાવવાનું ભગવાને કહ્યું નથી, આવી પડેલાં તપને હસતે મોઢે વધાવી લેવાનું કહ્યું છે. ત્યારે આ લોકો તો આવી પડેલા તપને આધાપાછા કરે, મોં મચ્યકોડે એટલે તે જ તપ જે આપવા આવ્યું હોય તેને અનેક ગણું કરીને પાછું આપી દે, અને ના આવેલાં તપને બોલાવવા જાય, ના હોય ત્યાંથી, કોઈનું જોઈને શીખી લાવીને તપ કરવા બેસે ! અલ્યા, તપ તે કોઈનું શીખી લાવીને કરાતું હશે ? તારું તપ જુદું, પેલાનું તપ જુદું, દરેકનું તપ જુદું જુદું હોય. દરેકના કોઈજી જુદાં જુદાં હોય અને આજના કાળમાં તો, તપ તો સામેથી સહેજે આવી પડે તેમ છે.

### કળિયુગમાં ઘેર બેઠાં તપ !

તમે તો કેટલા પુષ્યશાળી કહેવાઓ કે તમારે ઘેર બેઠાં જ અનાડી દેશ છે ! આપણે ઘરમાં પેઠા કે આપણા ઘરમાં જ અનાડી દેશ ! જમીએ ત્યાં જ, બાઈએ-પીએ ત્યાં જ, અનાડી દેશ બધો હોય. હવે અહીં આગળ તપ તપવાનું છે. ભગવાનને તપ ખોળવા સાઈઠ માઈલ વિચરવું પડ્યું હતું, અનાડી દેશ ખોળવા માટે ! જ્યારે આજે તો ઘેર બેઠાં જ અનાડીપણું લોકોનું નથી લાગતું ? તો મફતનું તપ મળ્યું છે તો શાંતિથી સહન કરી લો ને ! આ કાળના લોકો ય કેટલા પુષ્યશાળી છે ! આને પ્રાપ્ત તપ કહેવાય. આડોશી પડોશીઓ, ભાગિયા, ભાઈઓ, વહુ, છોકરાં બધાં ય તપ કરાવે એવું છે ! આગળના કાળમાં તો ઘેર બધી જ અનુકૂળતા રહેતી. આ

પ્રતિકૂળ કાળ આવ્યો છે, ઘેર બેઠાં જ પ્રતિકૂળતા હોય, બહાર ખોળવા જવું ના પડે. આ કાળ જ એવો છે કે કયાં ય એડજસ્ટમેન્ટ જ ના થાય. ઘરમાં, બહાર, પાડોશીઓ બધેથી જ ડીસ્ક્યુઅડજસ્ટમેન્ટ આવી પડે, તેને તું સહન કર અને એડજસ્ટ થઈ જા.

### પ્રાપ્ત તપને શાંતભાવે ભોગવો !

પ્રાપ્ત તપ એટલે આવી પડેલું તપ, એને શાંતિપૂર્વક નિરાંતે ભોગવે, સામાને સહેજ પણ દુઃખ ના થાય. સામાને આપણા નિભિતે દુઃખ તો ના થાય પણ આપણું મન સામાને માટે જ સહેજ પણ ના બગડે, એનું નામ પ્રાપ્ત તપ. બીજાં તપ કરવાની ભગવાને અત્યારે ના પાડી છે, તો ય જુઓને લોક જાતજાતનાં તપ લઈને બેઠા છે ! અલ્યા, સમજને ! શિષ્ય જોડે આખો દહાડો કોધ કરતો હોય ને બીજે દહાડે અપવાસ કરે, હવે આનો અર્થ શો ? મીનિંગલેસ આ બધી વસ્તુઓ ! આ મીનિંગલેસ નથી લાગતું તમને ? કહેશે કે, ‘મારે બે અપવાસ કરવા છે.’ અલ્યા ભાઈ, અત્યારે તો એવું છેને કે, કો’ક દહાડો રેશનનું ઠેકાણું ના પડ્યું હોય ત્યારે થોડા ચોખાથી ચલાવી લેવાનું હોય, એ દહાડે મહારાજ આટલાં જ ચોખા મળ્યા તે તેટલો જ ખોરાક, ત્યાં એ કરોને ! ખસ, માઈનસ કરી નાખોને ! એક દહાડો સામણું જ ના ખાવું, તેનાં કરતાં રોજ થોડું થોડું ખસ, માઈનસ કરીને આપણે એડજસ્ટ થઈ જાઓને ! કો’ક દહાડો જમવાનનું ઠેકાણું બે વાગ્યા સુધી ના પડ્યું તો ત્યાં શાંત ભાવે સહન કરી લે ને ! અથવા જમવાનનું બિલકુલ ઠેકાણું ના પડ્યું ત્યાં તું શાંત રહે. આ પેટ તો મહીં ગયા પછી બૂમ પાડશે નહીં. આ રાત્રે આટલી ખીચડી ને શાક આયું હોય તો પછી બૂમ પાડે ? ના પાડે. પછી

તમારે જેવું ધ્યાનમાં રહેવું હોય તેવું રહેવા દે. પેટને તો વાંધો નથી, આ વાંક પોતાનો છે, મન પણ એવું નથી, પોતે અનાડી છે. પોતે અનાડી, તે પોતે તો દુઃખ ભોગવે, પણ બીજાને પણ દુઃખ ભોગવડાવે. અનાડીપણું !

આજે તો આ લોકને સહન કરવાનું જરા ય છે નહીં, છતાં રોજ ગા ગા કરે ! આખી જિંદગીનું સરવૈયું કાઢે તો ય મહાન પુરુષનું એક દહાડાનું ય દુઃખ ના હોય, છતાં ય ગા ગા કરે !

### અહો ! કારુણ્યતા જ્ઞાનીની !!

અમને જ્ઞાન સુરતના સ્ટેશને થયું, તે ય ઓચિંતું જ ! મેં તો આમાં કશું નથી કર્યું. ‘ધીસ ઈજ બટ નેચરલ’ થઈ ગયું. એટલે લોકોને હું કહું છું કે નકલ કરવા જેવી નથી આ. ‘નેચરલ’ છે, પછી એમાં તું શું કરીશ ? હવે મારી પાસે આવ, હું તને રસ્તો દેખાડીશ. મને રસ્તો જડ્યો છે. બાકી, હું જે રસ્તે ગયો છું તે રસ્તે તું કરવા જઈશ તો માર્યો જઈશ. કારણ કે મારે તો પાશેરને બદલે સવાશેર થયું, તે મારાથી સહન નહોતું થતું. એ દિવસો કેમ કાઢવા તે તો હું જ જાણું.

આપણે શું કહીએ છીએ કે સર્વ દુઃખોના કથ્ય કરો. આ દુઃખો અમારાથી જોવાતાં નથી. છતાં અમને ‘ઈમોશનલ’પણ થતું નથી. એટલા જોડે જોડે વીતરાગ છીએ. છતાં સામાના દુઃખ અમારાથી સહન ના થઈ શકે. કારણ કે અમે અમારી સહનશક્તિ જાણીએ છીએ. અમારાથી દુઃખ સહન કેવું થતું હતું તે જાણીએ ને, તો એવું આ લોકો કેવી રીતે સહન કરી શકતા હશે એ અમને ઘ્યાલ છે એનો અને એ જ કારુણ્યતા છે અમારી !

- જય સચ્ચિદાનંદ.

### E-mail list for Dada Bhagwan egroup

Those mahatmas who would like to receive regular e-mails about Shibir, Satsang programmes, Telesatsang, Aaptsutra etc., please email their names and e-mail addresses to auvi@yahoo.com

## પૂજય ડૉ. નીરુબહેન આમીનના આગામી સત્સંગ કાર્યક્રમો

### મુંબદી

૮ ડિસેમ્બર (શુક્રવાર)	સાંજે ૬ થી ૮	વિષય : સમ્યક્ દર્શન શ્રી નાનુ હોલ, તેલંગ રોડ, માટુંગા (સે.રે.). ફોન : ૪૦૧૦૨૦૮
૯ ડિસેમ્બર (શનિવાર)	સાંજે ૬ થી ૮	વિષય : પતિ-પત્નીનો દીવ્ય વ્યવહાર લોકમાન્ય સેવા સંઘ, ત્રીજે માળે, તિલક મંદિર, રામમંદિર રોડ, વિલેપાર્લા (ઈસ્ટ). ફોન : ૬૧૨૮૮૨૬૬ (આત્મસાક્ષાત્કારનો ભેદજ્ઞાનનો પ્રયોગ)
૧૦ ડિસેમ્બર (રવિવાર)	સાંજે ૫-૩૦ થી ૮	ડૉ. સૂચ્યક હોસ્પિટલ, મંધુભાઈ રોડ, સબવેની સામે, મલાડ (ઈસ્ટ). ફોન : ૮૮૨૮૪૮૭ વિષય : ભાવ પ્રતિકમણ
૧૧ ડિસેમ્બર (સોમવાર)	રાત્રે ૮-૩૦ થી ૧૧	શ્રી મહાકવિ કાલિદાસ સભાગૃહ, પી..કે.રોડ, મુલુંડ (વેસ્ટ). ફોન : ૫૬૧૬૧૭૬

### અમદાવાદ

૧૩ ડિસે. (બુધ) સાંજે ૬ થી ૮ દાદા દર્શન, ઉસ્માનપુરા. નિમંત્રક : કલ્યાણબેન ચુડગર.

### વડોદરા

૨૨-૨૩ ડિસે.	સાંજે ૬ થી ૮-૩૦	લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, હરણી રોડ, કારેલી બાગ,
૨૪ ડિસેમ્બર	સવારે ૧૦ થી ૧૨-૩૦ } સાંજે ૪ થી ૭-૩૦ }	વડોદરા. ફોન : ૪૪૧૬૨૭ (આત્મસાક્ષાત્કારનો ભેદજ્ઞાનનો પ્રયોગ)

### આપણપુત્ર શ્રી દિપકળાઈ દેસાઈનો સત્સંગ

૮ ડિસે. (શનિવાર)	સાંજે ૬ થી ૮-૩૦	પ્રકાશ કામદાર, એ/૮૦૩, દેવરાજ ટાવર, કાલુપુર બેંકની પાછળ, જીસ બંગલો, બોડકદેવ, વસ્ત્રાપુર, અમદાવાદ.
---------------------	-----------------	---

### પરાણિાત ભાઈઓ માટે બ્રહ્માર્થ શિબિની

તા. ૨૯ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર, ૨૦૦૦

સ્થળ : 'દાદા દર્શન', ૫, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજ પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ.

ખાસ વિનંતી : શિબિરાર્થીઓએ અગાઉથી અમદાવાદ સેન્ટર પર વ્યવસ્થા માટે જાણ કરવા વિનંતી. ઠંડીની મોસમ હોઈ દરેક વ્યક્તિને ઓફ્વા-પાથરવાની ચાદર, એરપીલો સાથે લાવવા વિનંતી છે.

### કાર્યાટક જાત્રા - ટા. ૧ જાન્યુઆરી થી ૧૧ જાન્યુઆરી, ૨૦૦૧

મુડબીદી - મડીકેરી (હીલ સ્ટેશન) - બેલુર - હાલેબીડ - શ્રવણબેલગોળા (બાહુબલીજની વિરાટ પ્રતિમા)-  
મैસૂર - બેંગલોર વગેરે સ્થળો.